

શલ્યાનો ખુલ્લાનો

ભાગ ત્રીજો

: લેખક :

અધ્યાત્મા નસીરુદ્દીન 'નસીર' મુંઝાઈ

: અનુવાદક :

અકબર હંગીલ રાજન

: પ્રકાશક :

ખાનાએ હિકમત-ઈંડારાએ 'આરિઝ'

ઇંમનો ખજાનો

ભાગ ત્રીજો

: લેખક :

અણામા નસીરુદ્દીન 'નસીર' હુંગાઈ

Institute for
Spiritual Wisdom
Luminary Science
: અનુવાદક :
અકબર હળીલ રાજન
Knowledge for a united humanity

: પ્રકાશક :

ખાનાએ હિકમત-ઇંડારાએ 'આરિઝ'
3-એ, નૂર વીલા, ગાડીન વેસ્ટ,
કરાચી (પાકિસ્તાન)

જન્તના ખાણાનું મેજ

સાચા જ્ઞાનના નામોમાં એક નામ છે જન્તના ખાણાનું મેજ (TABLE) કે જે જમાનાના ઈમામના સેવકો માંહેના કોઈક સેવક તરફથી યોજવામાં આવે છે અને આ પ્રસંગશાપાત્ર કાર્યમાં તેઓ શરૂઆતથીજ એક સાથે છે અને તેઓ છે ભાઈ નસરુલ્લાહ કમરુદ્ડીન - ખાનાએ હિકમતના વાઈસ પ્રેસીડિન્ટ અને તેમના ધર્મપત્ની અમીના નસરુલ્લાહ અને આ એક ઘાઉફિજ ખુશીની બિના છે કે તેમના ઘારાં બાળકો પણ પોતાના માતા-પિતાના પગલે ચાલી રહ્યા છે.

અનુકમળિકા

1.	લેખક તરફથી બે બોલ	3
2.	કુરાનની છિકમતો, પવિત્ર આયાત અને એહલે જેત	8
3.	હ્યાસની છિકમતો	14
4.	દરજાવાર છિકાયતો	29
5.	કુસભાનીની છિકમત	39
6.	ત્રણ સવાલ - ભાસ્તથી	45
7.	આપકાર પ્રવચન	51

★ ★ *

બિસ્મિલ્હાહીર રહમાનિર રહીમ લેખક તરફથી બે બોલ

અદ્વાજાલાના ઈલો કરમથી અને રહુલે પાક હજરત મુહમ્મદ് (સ.અ.સ.), તથા પાક ઈમામો (અ.સ.)ની જહેરી અને બાતિની હિંદાયત તથા મદ્દથી “ઈલમનો ખજાનો ભાગ-૩” આપની સમજ હાજર છે. આ પુસ્તિકાનું જ્ઞાનની દેણી થકીનું મહત્વ અને તેનો શરૂઆતી પણ એકંદરે મારી અન્ય પુસ્તિકાઓ સમાન છે, છતાં આ પુસ્તિકામાં જે ખાસ ખાસ વાતો છે તે કુમવાર નીચે જગ્યાવેલાં વિષયોમાં જગ્યાવવામાં આવી છે.

આ પુસ્તિકામાં સૌથી પ્રથમ પવિત્ર આયાતની કંઈક હિકમતોનું વાર્ગન કરવામાં આવેલ છે જે મહાન અહેલેબેત અને મુહમ્મદ് (સ.અ.સ.)ની આલમાના ઈમામો અલૈહીમુસ્સ્લામથી સંબંધિત છે, અને તેવાં માનવુંત સાહેબોનો કેટલો ઊચો મરતબો છે કે ખુદાએ આલમીને તેઓને સર્વ પ્રકારે પાક અને પવિત્ર રાખ્યા છે, આ ઈસ્લામની એક એવી સચ્ચાઈ છે, એક એવી હકીકત છે કે તેને સારી રીતે સમજી લેવા બાદ દીને હક એટલે કે ખરા મજહબના ધારા ભેદ ખુલ્લી જાય છે. દાખલા તરીકે પંજતન પાક અને પવિત્ર ઈમામો (અ.સ.)ની નિર્દીષ્ટા અને પવિત્રતાની સચ્ચાઈને કબૂલ કરવાથી કુરાન (સમજવા)ની મુહેલીઓ એ રીતે સહેલી થઈ જાય છે અને હિકમતોના ધૂપયેલાં ખજાનાઓ એ રીતે મળી જાય છે કે જેમ કરમાવેલું છે કે “ઈન્ના તકુરાનુન કરીમ” ૫૬/૩૭ “દી કીતાબીમહનૂન” ૫૬/૩૮ “લા યમસ્સુહા

ઇହલ મુતહહરેન” ૫૬/૭૮. ચોક્કસપણો આ એક માનનીય-પૂજ્ય કુરાન છે કે જે એક સુરક્ષિત પુસ્તકમાં લખાયેલું છે-સમાયેલું છે, કે તેને સિવાય પવિત્ર લોકોના કોઈ અન્ય હાથ નથી લગાડી શક્તનું એટલે કે અડી નથી શક્તનું. આ ફરમાનથી સાંશ સાંશ સ્પષ્ટ થઈ જાય છે કે પંજતન અને ઈમામોના અહેલેબેતના પાક અને પવિત્ર હોવાનો ઊચ્ચ હેતુ એ છે કે આ માનનીય અને પવિત્ર હસ્તીઓ ગુપ્ત પુસ્તક એટલે કે કિંતાબે મહનૂર સુધી પહોંચી જાય કે જેમાં કુરાન સુરક્ષિત છે.

આ ગુપ્ત પુસ્તક, ભલે પદ્ધી લોહે મહેકુળ હોય કે પદ્ધી રૂહાનીયતની અમલમાં આવનાર તાવીલ એટલે કે રૂહાનીયતનું વ્યવહારું જ્ઞાન ધરાવનાર ગૂઢાર્થ, જે પણ હોય તે અન્યોની પહોંચથી ઊચ્ચ છે અને તેનો અર્થ એમ થાય છે કે અહેલેબેતના માનવંત લોકો (જેમાં પવિત્ર ઈમામો પણ છે)ના સિવાય કોઈ માણસ કુરાન સંબંધેની રૂહાનીયત અને ડહાપગભરી હિકમતના આ દરજજા ઉપર બીરાજ નથી શક્તો. માટે એવી હકીકતોના તરફ ધ્યાન દોરવાના હેતુથી અહીં પવિત્ર આધ્યાત્મનો વિષય ચર્ચા હેઠળ લાવવામાં આવ્યો છે.

બીજો નિબંધ “ખાસીદૃષ્ટિનાલ” છે જેમાં નબી સાહેબની હ્યાસ (હ્યાસે નબવી) મુજબ અલી (અ.સ.) અને ઔલાદે અલી થકી ઈમામો (અ.સ.) તાવીલના ધારુણી છે, (તાવીલ એટલે કે કુરાનનો ગૂઢાર્થ અને તેને જ્ઞાનનારાઓ હજત અલી (અ.સ.) તથા તેમનાં વંશમાંથી ચાલતનારા ઈમામો (અ.સ.) છે) તેની હિકમત વાર્ણવવામાં આવી છે. અહીં ખુલાસો એ કરવામાં આવેલો છે કે હજત મૌલા અલી (અ.સ.)ના પવિત્ર વ્યક્તિત્વના કાળમાં કુરાનની તાવીલનો

આરંભ થયો અને દેક સમયના ઈમામે પોતાના વખતમાં-સમયની માંગ મુજબ તાવીલનો એક ભાગ લોકોની સામે રજુ કર્યો. આ પ્રમાણે ધીર ધીર સમયના ઈમામ મારશ્ત કુરાનની તાવીલ જાહેર થતી ચાલી આવી. આ બનાવ ઉપરથી એક તરફ તો એ સાબિત થયું કે ખુદા અને રસૂલના પછી ઉલીલ અમૃ એટલે કે હુકમના માલીક-જીમાનાના ઈમામ-ની તાબેદારી દરજ છે અને સાચાં ઈમામ (સત્ય માર્ગના બેદ જાળનાર ઈમામ (અ.સ.) એ જ ઉલીલ અમૃ છે, જ્યારે કે બીજી તરફ એ સચ્ચાઈ સ્પષ્ટ થાય છે કે ઈસ્લામ દીનની પ્રગતિ અને ઉન્નતીનો બેદ એ વાતમાં ધૂપાયેલો છે કે ઉલીલ અમૃના મારશ્ત (ઉલીલ અમૃના વસીલાથી) દરજાવાર તાવીલની આજાઓ ઉપર અમલ કરવામાં આવે જેથી વખત અને જ્યાની માંગ મુજબ તથા ઈસ્લામની જીવન પદ્ધતીના કાયદા પ્રમાણે દીન અને દુનિયાની સફળતાઓ પ્રાપ્ત થાય.

ત્રીજો વિષય છે “દરજાવાર છિદાયત” જેનો હેતુ એ વાત સાબિત કરવાનો છે કે કુરાનના નિયમનો પૂરી રીતે અમલ કરવો અને ઈસ્લામી છિદાયતનું ચલાગુમાં આવવું દરજાવાર એટલે કે ધીર ધીર થયું છે અને તેની સાબીતી હજરત મહેમદ પણગમ્બર (સ.અ.સ.)થી પહેલાં એક શરીયતના પછી બીજી શરીયતનું આવવું છે અને નામદાર પણગમ્બર સાહેબ (સ.અ.સ.)ના વખતમાં તન્જીલ એટલે કે કુરાનનું નાજીલ થવું અને તાવીલ ઉપર અમલ કરવું છે. દાખલા તરફિ “ખાસીક્લનાખલ”ની હંડીસ દ્વારા સ્પષ્ટ થાય છે કે નબી સાહેબ (સ.અ.સ.)નું તન્જીલી યુદ્ધ તેવાણ માનવંત (સ.અ.સ.)ની પંવિત્ર હૈયાતીમાં હતું અને અતી મુર્તુજી (અ.સ.) તથા તેવાળના

વારસદારો-ઈમામોનું તાવીલી યુદ્ધ તે પદ્ધી થનાર હતું.

ચોથો વિષય “કુરબાનીની છિકમત” છે જેનું મહત્વ એ છે કે આ ઈબાદત એટલી જૂની છે, અને તેનો ઈતિહાસ એટલો લાંબો છે કે હજરત આદમ (અ.સ.)ના સમયથી લઈને આજ સુધી ડોઈ એકો વખત પસાર થયેલો નથી દેખાતો કે જેમાં પ્રકાર પ્રકારની સાચી અને જોઈ કુરબાનીઓ ન દેવામાં આવતી હોય માટે એ કામ જરૂરી હતું કે કુરબાની સંબંધે કંઈક ફાયદામંદ વાતો બતાડવામાં આવે.

પાંચમો નિબંધ છે “ભારતથી ત્રણ પ્રશ્નો”. અમારા માટે સવાલના જવાબ દેવા અને તેને પ્રગટ કરવાનું એટલા માટે અતીશય જરૂરી છે કે સવાલ દીન મજહબની એ બાબતો વિષે કરવામાં આવે છે કે જેમાં લોકોને શંકા ઉદ્ભવે છે અને જો એવા સવાલોને માટે જવાબો મળવી આપવામાં ન આવે તો ધરિ ધરિ લોકોને દીન શંકાભરેલો નજરે આવશે અને એ બાબત પણ વ્યાજબી છે કે દેરેક સવાલનો જવાબ અથવા તો સીધો હોય છે અથવા તો આડકતરો હોય છે. આ જન્મેમાંથી જે યોગ્ય લાગે તેમજ કરવું જોઈએ. જો તમો સામાન્ય હાલતમાં લોકો સમક્ષ જ્ઞાનના મોતીઓ વિઝેરી છ્યો તો પદ્ધી પણ તેના તરફ ખૂબ ઓછું લક્ષ આપવામાં આવશે. તથી વિરુદ્ધ જો તમો દલીલો અને સામસામી ચર્ચા કરવાના સ્વરૂપે જ્ઞાનની વાતો કરશો તો તમારા લોકો ચક્કા થઈ જશે, ચમકી જશે અને કાન ઉભા કરીને અર્થાત ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવા લાગશે.

જો ઈસમાઈલી જ્ઞાન ઉમદા પુસ્તકોના સ્વરૂપમાં સામાન્ય અથવા સહેલું થઈ જાય તો પદ્ધી સવાલો ઓછા અને ઓછાં થઈ

જરો. ડેમકે આ એવી વાત બની જશે કે જાગે કે ધ્યાન પ્રકારના સવાલોના માટે તમોએ પહેલાંથી જ જવાબો તૈયાર કરીને રાખ્યા હોય અને જે જે પુસ્તકોને સંખળતા મળી છે તેની એક નીશાની એ જ હોય છે કે તેના અભ્યાસથી ધ્યાન બધા સવાલો ઉંલાઈ જાય છે અને તેમ થવાથી શંકા કુશાંકાઓ પણ વિલીન થઈ જાય છે, અને જથારે શંકા નિકળી જાય છે તો તેની જથ્યાએ વિશ્વાસ આવી જાય છે અને એવા જ જ્ઞાનને વિશ્વાસનું જ્ઞાન એટલે કે ઈન્દ્રમુલ યકીન કરે છે.

અમો પરવરદીગારે આતમ તરફથી મળેલ ઈન્દ્રમી ન્યામતો માટે તેનો દીલ અને જાનથી આભાર માનવા ઈન્દ્રણીએ છીએ કે નેણે પોતાના ઈજલો કરમથી આ પાક અને પવિત્ર ન્યામતો અર્પણ કરી અને જ્ઞાનના હેતુને પાર પાડવા—તેમાં પ્રગતી સાધવાના જાહેરી અને બાતિની રસ્તાઓ (વસીલાઓ) પ્રાપ્ત કરાવ્યા એ જ ખુદાવંદ બરહ્ક છે જેણે ઈમાન રાખનારાઓની નેક દુઅઓને લીધે ખીદમતની—સેવાની લાગણી જન્માવી અને ધ્યાનબધા જ્ઞાનની ચાહના ધરાવનારા ભિત્રો ને સદ્બુદ્ધિ આપી કે તેઓ જ્ઞાનની સેવા માટે ભરપૂર સહજાર કરે, અતહભોગિત્વાહી આલા અહેસાન.

Knowledge for a united humanity

ઇક્ષુન જમાતનો એક જ્ઞાનના કેત્રનો સેવક
નસીરુદ્દીન નસીર હુંગાઈ
સ્વીવાર ૨૦ રમજાનુલ મુખાસ્ક ૧૯૮૭ હીજરી
૪ ડિસેમ્બર ૧૯૭૭ ઈસ્વી.

કુરાનની હિકમતો

પવિત્ર આયાત (તતહીર) અને અહેલે બૈત

અદ્વાહ તબારક વ તઆલાતું ફરમાન છે કે “ઈન્મા યુરીદુખાષુ
લીયુજ હીબ અન્કુમુરીજિસ અહેલલૈતી વ યુતહીર્ઝમ તતહીરા
(33/33). સિવાય તેના કાંઈ જ નથી કે અદ્વાહનાલા ચાહે છે કે કે
અય અહેલેબૈત (રસૂલના ધરવાળાઓ) તે તમારાથી દરેક પ્રકારની
અપવિત્રતાને દૂર રાખે અને તમને એવા પવિત્ર રાખે જેમકે પવિત્ર
રાખવાનો હક છે.

એ રિવાયત મશાહુર છે કે ઉપર જગ્ગાવેલી આયાત પંજતન
પાકના વિષે નારીલ થઈ હતી અને આ બનાવ હજરત નબી સાહેબ
(સ.અ.સ.)ની ધર્મપણી ઉમ્મે સત્ત્વમાના ધરમાં બન્યો હતો અને હજરત
નબી સાહેબ (સ.અ.સ.)એ હજરત અલી (અ.સ.) અને બીબી શિતેમા
(અ.સ.) તથા હજરત હસન અને હજરત હુસૈન (અ.સ.)ને બોલાવ્યા
અને તેઓ ઉપર પોતાની ચાદર ઓઢાડી દીધી અને તેવણું પોતે પણ
તેમાં દાખલ થઈ ગયા, પછી ફરમાવ્યું “ઓ મારા અદ્વાહ ! આ છે
મારી અહેલેબૈત, જેમના વિષે તે મારી સાથે એ વાયદો કર્યો કે જે
તે કર્યું યા અદ્વાહ તું તેમનાથી રીજિસ (નાપાકી)ને દૂર રાખ અને
તેમને પવિત્ર રાખ, એ પ્રમાણે કે જે પ્રમાણે પવિત્ર રાખવાનો હક છે,
ત્યારે ઉમ્મે સત્ત્વમા બોલી ઊઠ્યાં કે, “ઓ રસૂલ (સ.અ.સ.) ! શું હું

પાગ તેઓમાં ભળી શકું છું (શામેલ થઈ શકું છું) ?” ત્યારે તેવાગુનામદારે ફરમાવ્યું , “ઓ ઉમ્મે સત્ત્વા ! નહીં, તને એ ખુશખબરી હોકે તું નેકી ઉપર છો.”

હિક્મત નંબર (૧) : મજફૂર પવિત્ર આયત થકી એ હકીકત સંપૂર્ણપાંગે સ્પષ્ટ અને જાહેર થઈ જાય છે કે તે માનવત પંજતન, એટલી ઊર્ધ્વી હદ સુધી પવિત્ર છે કે હક સુખભાને એટલે કે અખાહ પાકે તેઓને રહેમત અને મહેરબાનીની જેટલી હેઠે (કમાલીયતની હદ સુધી) હોવા જોઈએ તેટલી હેઠે પવિત્ર રાખ્યા છે અને તેઓને દરેક પ્રકારની પવિત્રતા અને શુદ્ધતાના નમૂના તથા દરેક પ્રકારની પવિત્રતા અને શુદ્ધતાના મૂળ બનાવ્યા છે.

હિક્મત નંબર (૨) : પવિત્ર અહેલેબેત (અ.સ.)ની આ પવિત્રતા જાહેરી પાગ છે અને બાતિની પાગ છે. રૂહાની પાગ છે અને શારીરિક પાગ છે. દીની પાગ છે અને દુન્યવી પાગ છે. એટલે સુધી કે તેઓ માનવત દરેક પ્રકારે પાક અને પવિત્ર છે અને તેમાં તલ ભાર પાગ શંકાને સ્થાન નથી.

હિક્મત નંબર (૩) : આ મુખારક આયતમાં કે જે આયતે તનહીરાના નામથી પ્રખ્યાત છે, પંજતનનો અતી ઉત્ત્યતમ દરજજા સુધી પવિત્ર હોવાનો ઉદ્દેખ છે, અને આ એવી પવિત્રતા છે કે મનુષ્ય જગતમાં તેવી પવિત્રતાથી ઉપર કોઈ અન્ય પવિત્રતા નથી હોઈ શકી, જ્યારે કે આ મુખારક ફરમાનમાં પંજતનની મહાન હસ્તીની પાડીઝારી અને પવિત્રતા અતીશયોજિતની હેઠે જઈને અંતાઈ છે.

હિક્મત નંબર (૪) : એ બાબતને સૌ કબૂલ કરે છે કે હજાર રસૂલ (સ.અ.સ.) શરૂઆતથી જ પાક-પવિત્ર હના, માટે જ્યારે તેવાગ નામદાર પોતે પાગ અહેલે બૈતની પવિત્રતા (તતહીર)ના આ અમલમાં ભેગા થઈ ગયા ત્યારે તેમાં પવિત્રતાની કલ્પના ખૂબ જ બુચાઈએ પહોંચી ગઈ અને તેના થડી કેટલીય સર્વચાઈઓ સાબીત થઈ ગઈ, અને તેઓમાંની એક તો એ છે કે કુરાઓન અને હંડીસના પ્રકાશમાં હજાર નબી સાહેબ (સ.અ.સ.)ના વખારણે પાત્ર ગૂંગોની જે કલ્પના છે તે જ કલ્પના માનવંત અહેલેબૈતની અન્ય વ્યક્તિઓના ગુર્યસૂદ્ધગૂંગોની પાગ છે કારણ કે ખુદાવંદ આલમીને આ હિક્મત સભર આયતમાં સધળા પવિત્ર અહેલેબૈત (અ.સ.)ને નિર્દીષ્ટતા અને પવિત્રતાનાં એક જ દરજજામાં માદ ફરમાવ્યા છે.

હિક્મત નંબર (૫) : આ પવિત્ર આયતમાં અદ્વાહનઆલાનો ઈરદ્ધાનો (અદ્વાહનઆલાના ઈરદાનો) ઉદ્દેખ છે કે જે અહેલેબૈતને દેખે પ્રકારની ખરાબીઓથી પાક રાખવા સંબંધે છે. અહીં એ જાણવું જોઈએ કે ખુદાવંતઆલાનો ઈરદ્ધો નવો નથી પાગ ધાર્ણો જૂનો છે. એટલે કે જે બુર્જુર્ઝ (માનવંત) હસ્તીઓના વિષે પસ્વર્દીંગારે આલમનો એ ઈરદ્ધો હોય કે તેઓ પાક થઈ જાય તો એ ઈરદ્ધો ધાર્ણો પહેલાંથી મૌજૂદ હોય છે અને તેવાગ માનવંત વ્યક્તિઓ ઈલાહી ઈરદાની અસર હેઠળ ધાર્ણા પહેલેથી જ પાક-પવિત્ર હોય છે અને ન કે તે મધ્યી.

હિક્મત નંબર (૬) : હવે સંવાદ રહ્યો આયતે તતહીરના નાજીલ થવાનો અને એ અમલનો કે જે નામદાર પયગમ્ભર સાહેબ પદ્ધીથી પોતાના પવિત્ર અહેલેબૈતને બોલાવી તેઓ ઉપર પોતાની

ચાદર ઓળાડી દીધી અને તેમના હકમાં પવિત્રતા માટેની દુઆ ફરમાવી, જે ઉપરથી એમ જગ્યાય છે કે તેવાગુ માનવંત વ્યક્તિઓની પાકીજગી તે વખતે અમલમાં આવી કે જ્યારે ખુદાતાલાએ આ ફરમાન ફરમાયું અને જ્યારે હજરત રસૂલ (સ.અ.સ.)એ તેના માટે દુઆ માંગી. પરંતુ વાત દર અસલ એ છે કે ખુદા અને રસૂલના તરફથી આ અનંતમાંની સાચ્યાઈની અમલી સાબિતી રજૂ કર્યી હતી કે મહાન અહેલેબેત આવા પાક-પવિત્ર છે, જેને લીધે લોકો તેને સરળતાથી સમજી શકે.

હિક્મત નંબર (૭) : કુરાખાન શરીરની ઘણી આયતોમાં મોમીનોની રૂહની તથા જીસ્માની પવિત્રતાનો પાગુ ઉદ્દેખ આવેલો છે, જેના કારણે અહેલેબેતની ઊચ્ચ વ્યક્તિઓની નિર્દીષ્ટતા અને પવિત્રતા હજુ વધુ ઊચ્ચ, નજરે પડે છે, તે એ રીતે કે મોમીનોનું પવિત્ર થઈ જવું રસૂલ (સ.અ.સ.) તથા અહેલેબેતનાં વસીલાથી (તેમના મારફત) થાય છે અને જ્યારે પાગુ કોઈ મોમન પાક થઈ જાય છે તો તેને અહેલેબેતની નિર્દીષ્ટતાની ઊચ્યાઈની ખાત્રી એ પ્રમાણે થાય છે કે જેમ એક નાનું બચ્ચયું એમ સમજતું હતું કે પર્વતનું શિખર આકાશને એડે છે પાગુ તેને જ્યારે તે શિખર ઉપર પહોંચાડવામાં આવ્યું ત્યારે તેને જાગુ થઈ કે એ તેનો બ્રમ હતો કે આકાશનું છાપડું પર્વતના શિખર ઉપર રાખેલું છે અને સત્ય એ છે કે આકાશ તો પર્વતો કરતાં પાગુ ઘણું ઊચ્ચ છે.

હિક્મત નંબર (૮) : મનુષ્યપાગાના દરજજા ઉપર એથી વધીને પવિત્રતા અને પાકીજગી તથા સાંદ્ર દીલી અને પાક બાતિની બીજી કરી હોય કે ખુદાતાલા કામીલ ઈન્સાનોને એટલે કે સર્વગૂણસંપત્તન

માનવીઓને અર્થાત જમાનાના ઈમામને આરંભથી જ સુંદર ચારીએના ઊચ્ચ દરજજા ઉપર રાખે છે અને તેવાળને પોતાના હિંદાયતના નૂરનું જાહેરી સ્વરૂપ બનાવીને દરેક પ્રકારની નેકી અને ભલાઈનું સાધન ગાગાવે છે. નબુવ્યત અને વિલાયતનો દરજજો એવો જ હોતો હોય છે.

હિક્મત નંબર (૮) : અદ્વાહ તાલાએ જે રીતે પોતાના રસ્યુલે બરહક (સ.અ.સ.)ને હિંદાયતનું નૂર ધરાવનાર બનાવવાને માટે શરૂઆતથી જ પાક-પવિત્ર રાખ્યો હતો, તેજ રીતે આપ નામદાર (સ.અ.સ.)ની અહેલેબેતને પાગ આરંભથી, જ પાક રાખી હતી કે જેથી સદાયના માટે હિંદાયતનો ક્રમ ચાલતો જ રહે અને તેમાં ક્રોઈ પાગ પ્રકારની ભેળસેળ ન થાય.

હિક્મત નંબર (૯૦) : હજરત પયગમ્બર સાહેબ (સ.અ.સ.)ના પવિત્ર ચારીએ તથા પાક બાતીના જેટલા ઈશારા અને ઉલેખ કુરાયાનમાં મૌજૂદ છે તેમાં તેવાળ નામદાર (સ.અ.સ.)ની અહેલેબેત પાગ ભગેલી છે અને તેવાળ માનવંત લોકોની આ ખાસ નિર્દીષ્ટતા અને પવિત્રતા હજરત રસ્યુલ (સ.અ.સ.)ની સાથે સાથે એ માટે છે કે જેથી ખુદાના પયગમ્બર (સ.અ.સ.) પછી પાગ દીન-મજાહબમાં જ્ઞાન-ઈલમ અને હિક્મત તથા હિંદાયતની પ્રગતીનું કેન્દ્ર કાયમ અને બાકી રહે.

હિક્મત નંબર (૧૧) : કુરાયાનની સૂરહ રરની આયત ૩૦માં મૂર્તિપૂજા એટલે કે બૂતપરસ્તીને અપવિત્ર ગાગાવવામાં આવી છે અને તે બે પ્રકારની હોય છે એટલે કે જાહેરી બૂતપરસ્તી અને બાતિની-બૂતપરસ્તી. જાહેરી બૂતપરસ્તીથી બચી જવું ધારું સહેલું છે પરંતુ બાતિની બૂતપરસ્તીથી બચ્યવું દરેક મનુષ્યના વરણી વાત નથી સિવાય

પવિત્ર અહેલેબૈતના. કારણ કે તેઓ નામદાર દરેક પ્રકારની ખરાબીઓથી પાક અને પવિત્ર છે. બાતિની બૂતપરસ્તી એ છે કે કોઈ માનવી ખુદાને ન ઓળખતો હોય, કોઈ અન્યને ખુદા માનતો હોય, હરામ અને ગેરવ્યાજબી (નાજાઈજ)થી મહોભત કરતો હોય અને હલાલમાં માઝકસર રીતે કામ ન લેતો હોય, ખુદાની નજરમાં આ સધળી વસ્તુઓ અપવિત્રતા (નાપાકી) છે, જેનાથી માનવંત અહેલેબૈતની વ્યક્તિઓને ખુદાએ પાક-પવિત્ર રાખી છે.

છિક્કમત નંબર (૧૨) : ઈસ્લામની આ એક સામાન્ય માન્યતા છે કે મન એટલે કે નક્ષસને પવિત્ર કરવાથી બાતિનની સંશોધણી દર્શેશ મનુષ્યના મન-મગજમાં અને હૃદયમાં તૃણાનીયતનો પ્રકાશ ઉત્પન્ન થાય છે અને એવો માનવી જાણો કે ફરીસ્તો બની જાય છે. હવે જો એક સામાન્ય મોભીન બંધાની પાક બાતિન હોવાથી આ પરિણામ આવે તો તે ઊચ્ચ અને પવિત્ર તથા મહાન હસ્તીઓના હૃદય અને મનની પવિત્રતાની શું સ્થિતિ હોણે કે જેમને ખુદાએ પોતે અજલથી એટલે કે દુનિયાના આરંભ કરતાં પણ પહેલાંથી પાક અને પવિત્ર બનાવ્યાં છે. આ ઉપરથી સ્પષ્ટપણે જાહેર થયું કે પવિત્ર અહેલેબૈત (અ.સ.) આ અર્થમાં ખુદાના નૂર છે.

છિક્કમત નંબર (૧૩) : કુરાનની સુરહ ૧૭ આયત ટ્પમાં છે કે “તૃહ અસલમાં આલમે અમરથી (તૃણાની દુન્યાથી) છે.” એટલે કે તે આ માનવજાતિની સૃષ્ટિના (આ ર્યના પામેલા) જગતમાહેની નથી તથી તે એક અનાદી જોહર-સત્ત્વ અને નૂર છે. તે એક પ્રકાશિત જગત છે તેમાં ખુદાની કુદરત તથા શક્તિની ચિત્રવિચિત્રતાઓ દ્રષ્ટિમાન

ધ્યાય છે પરંતુ રૂહના કાયદાના આ સંઘળા ગ્રૂપો હજરત રસૂલ (સ.અ.સ.) અને તેવાળના કુટુંબીઓના માટે ખાસ છે, જેના વિષે ખૂદાનાલાએ ફરમાવેલું છે કે તે પોતાના અસલ અને અનાદી સ્વરૂપમાં પાક અને પવિત્ર છે.

હુકમત નંબર (૧૪) : એ જાગુવું જોઈએ કે સર્વ પ્રથમ અહેલેબેત પંજતન પાક છે અને તે પછી આલે નબી ઔતાદે અલી (અ.સ.)ના સંઘળા પવિત્ર ઈમામો છે. કેમકે અહેલેબેતનો આ ઈશારો હજરત રસૂલુલ્હાહ (સ.અ.સ.)ના એવા કુટુંબીઓ એટલે કે ધરના લોકોની તરફ છે કે જે શારીરિક સંબંધ સિવાય આસમાની જ્ઞાન અને હીદાયતના દરજજામાં પાગ હજરત નબી સાહેબ (સ.અ.સ.)ની નજદિક રહેનારા એટલે કે સ્ત્રાથીદાર છે. એ જ માનવંત લોકો ઝીકરવાળાઓ, હુકમના માલિક અને સાચા ઈમામ કહેવાય છે અને અદ્વાહિતાલાએ એ જ પૂજ્ય લોકોને દરેક પ્રકારની માનવીય નબળાઈઓ, દરેક પ્રકારની જામીઓ તંથા દરેક પ્રકારની બુરાઈઓ – ખરાબીઓથી પાક અને પવિત્ર રાખેલ છે.

Knowledge for a united humanity

હદીસની હિક્મત

“ભાસીકુલાયલ”

આ હદીસ સુની અને શીયા (ઇસ્નાઅશરી તથા ઇસમાઈલી)ના હદીસોના પુસ્તકોમાં પ્રખ્યાત છે અને મે આનો “હાલાત વ મજાલાતે સહાબા (ર.અ.)” નામના પુસ્તકમાંથી ઉતારે લીધો છે.

અબુ સઈદ અલ અઝહરી (ર.અ.)એ ફરમાવેલું છે કે અમો હજરત રસૂલુલ્હાય (સ.અ.સ.)ની સાથે જઈ રહ્યાં હનાં ત્યાં આપ નામદારના જોડાની પદી ટૂટી ગઈ, ત્યારે હજરત અલી (અ.સ.)એ તેને (જોડાને) ઉપાડી લીધા અને તેની પદીને ઠીક કરવા લાગ્યા. જોડાને ઠીક કર્યી પદી આપ નામદાર કરી ચાલવા લાગ્યા અને ફરમાવ્યું :

“યા અચ્યુહનાસુ ઈન્ન મીન્કુમ મંચ્યુકુતાતુ અલા તાવીલીલ કુરાની કમા કાતલ્યુ અલા તન્જીલ.” કાલ અબુ સઈદ ઈ ખરજતુ ઈ બશરતુ બીમા કાલ રસૂલુલ્હાય સહી. અલ્હાય અલેહી વ આલેહી વસ્ત્વમ ઈ લમ્યકનરસ્ત બીહી ફરહન કાનંહુ કણ સમ્ભ.

તરજીમો : અય લોકો, તે માણસ તમારામાંથી છે કે જે કુરાનની તાવીલ ઉપર લડાઈ કરશો તે રીતે કે જે રીતે મે કુરાનની તન્જીલ ઉપર લડાઈ કરી છે. અબુ સઈદ કહે છે કે હું તે ટોળામાંથી નિકળ્યો અને હજરત અલી (અ.સ.ક.)ને આ દીવ્ય પ્રેરણાની વાગ્યી (આ ખુશાખબર) સંભળાવી કે જે હજરત રસૂલુલ્હાય સહમે અમોને

સંભળાવી હતી, પણ હજરત અલી (અ.સ.) એ વાત ઉપર એટલા વધુ રાજી ન થયા, એમ લાગ્યું કે જાણે હજરત અલી (અ.સ.) આ ખુશબુદ્ધિ પહેલેથી સાંભળી ચૂક્યા હતા.”

(૧) અહી સર્વ પ્રથમ એ વાત સાબિત થાય છે કે તન્નીલ અને તાવીલની આ બન્ને નિશાનીઓ – આ બન્ને શબ્દ પ્રયોગો – ખુદા અને રસૂલ (સ.અ.સ.)ની ઈચ્છા, (ઇશારા, હેતુ) મુજબ છે કેમકે જો એ પ્રમાણે ન હોત તો આવી ઉચ્ચ હદ્દીસમાં તેની મહત્વતા અને ક્ષયદાઓ તથા સંજોગ અને પ્રસંગનો ઉદ્દેખ જ ન હોત અને ન તો એ સત્ય તરફ ઈશારો કરવામાં આવતે કે તન્નીલનો જમાનો નબુદ્ધતનો જમાનો હતો (નબુદ્ધતનો સમય હતો) અને તાવીલ ઈમામના પૂરા અરસા (પૂરા યુગ)માં ફેલાયેલી છે.

(૨) આ હદ્દીસ થડી એ પણ જાણેમાં આવ્યું કે હજરત નબી મહામદ (સ.અ.સ.) તન્નીલના માલીક છે એટલે કે સાહેબે તન્નીલ છે અને મૌલાના અલી (અ.સ.) સાહેબે તાવીલ છે અને તન્નીલ તથા તાવીલ બન્નેમાં આસંમાની એટલે કે ઈશ્વરી આજ્ઞાઓ અને હીદાયત છે, એ મુજબ એ કાર્ય જરૂરી છે કે ખુદા અને રસૂલ (સ.અ.સ.)ની આજ્ઞા પ્રમાણે તન્નીલી એટલે કે નાઝીલ થયેલી આજ્ઞાઓના પછી તાવીલી એટલે કે તેના ગૃહ્ણાર્થની હિદાયતો પણ શરૂ થઈ જાય જેથી ધરિ ધરિ બને પ્રકારની હિદાયતોથી મોભીનોને ક્ષયદો અને લાભ મળે.

(૩) તન્નીલનો હેતુ છે કુરાયાનનો જાહેરી અર્થ અને તાવીલ, એ કુરાયાનની બાતિની હીક્રત છે માટે એ સાબિત થયું કે અલી

(અ.સ.) પયગમ્બર સાહેબ (સ.અ.સ.)ના જાનશીન એટલે કે વારસદાર એ માટે છે કે નામદાર પયગમ્બર સાહેબ (સ.અ.સ.) પદી દુનિયા અને જમાનામાં આવનારા ફેરફારો થકી જે પાણ ક્રોયડાઓ ઉભા થશે તનો ઉક્લ જો તન્જીલ દ્વારા નહી હેય તો તાવીલ મારફત દેખાડી દેવામાં આવે અને તેનેજ કહે છે બાદ કરવું અથવા કાઢી નાંખવું એટલે કે એકમાંથી બીજી જરૂરી વસ્તુ કાઢી આપવી.

(૪) આ હ્ઠીસની હિકમત સમજવાથી જગ્ગાશે કે હજરત મહેમદ પયગમ્બર (સ.અ.સ.)ના વખતથી લઈને જ્યામત સુધી ઈમામતની પરંપરા ચાલતી રહેનાર અને બાકી રહેનાર છે કારણ કે હજરત અલી (અ.સ.) આ હ્ઠીસમાં ઈમામતના નૂરની પરંપરાનો મૂળ વિષય અર્થાત ઉદ્ભવસ્થાન છે એટલે કે જે કાર્યના માટે ફરમાવવામાં આવ્યું છે (તે કામ) હજરત અલી (અ.સ.) કરશે તો તનો અર્થ એમ છે કે તે કાર્ય ચોક્કસપાણે હજરત અલી કરશે પણ ન ફક્ત વ્યક્તિગત તરીકે બલ્કે પોતાની પવિત્ર ઔલાદના ઈમામતની પરંપરા મારફત પણ.

(૫) પયગમ્બરે બરહ્જ (સ.અ.સ.)ના આ મુખારક ફરમાનમાં જહેરી જેહાદ અર્થાત ધર્મયુદ્ધના પદી બાતીની જેહાદ કરવાનો ઉત્તેખ આવેલાં છે કે જે ઈમામ (અ.સ.) દેખ જમાનામાં ઈલ્મ-જ્ઞાનની ઝુલ્લિકાર (તત્ત્વાર)થી કરતા રહેશે જેનો અર્થ એમ છે કે દીનમાં ફક્ત શરીરીન નથી બલ્કે તરીક્ત હુક્કીક્ત અને મારફત પાણ છે. જો એમ ન હોત તો તાવીલી યુદ્ધ અર્થહીન થઈ જત.

(૬) જે પ્રમાણે તન્જીલ મર્યાદિત છે અને તન્જીલી યુદ્ધ પાણ મર્યાદિત છે તે જ રીતે તાવીલ અમર્યાદ છે અને તાવીલી યુદ્ધ પાણ

અમ્ભર્યાદ છે. તેનો અર્થ એ છે કે જાહેરી યુદ્ધ ક્રક્ત શારીરિક રીતે કરવામાં આવે છે અને બાતીની યુદ્ધ રૂહાની અને ઈલમી એટલે કે જ્ઞાન મુજબ કરવામાં આવે છે જેના ઘણા પ્રકાર છે.

(૭) હજરત અતી (અ.સ.) કે જેઓ વખતના ઈલમામના સ્વરૂપમાં મૌજૂદ અને હાજર રહે છે, તેના તરફથી એક સર્વબ્યાપ્ત અને લાંબા ગાળાનું ધર્મયુદ્ધ એ છે કે જેના થકી દુનિયાવાળાઓ જમાનાના અહેવાળોની અસરમાં આવીને પોતાની માન્યતાઓમાં ફેરફારો કરવા માટે લાચાર થઈ જાય છે અને જો એમ કરવામાં ન આવ્યું તો જમાનાની સાથે સાથે આગળ નથી વધી શક્યું.

(૮) એ બાબત સર્વ માટે એક સંય છે કે ઈસ્લામ મજહબ કુરતી મજહબ છે અને કુરતનો સૌથી ઉત્તમ નમૂનો અને તેની સૌથી સરસ ઉપમા મનુષ્ય છે (ઇન્સાન છે), અને મનુષ્યમાં વર્તાઈ રહેલ એટલે કે જાહેરમાં નજરે પડતો કુરતનો નીયમ એ છે કે તે ધીર ધીર (એક પછી એક પગલે) પ્રગતી કરે છે, (તેમાં ફેરફાર આવે છે) તે બદલાઈ જાય છે. તે ઘણા સંજોગોમાંથી પસાર થઈ જાય છે અને એક પછી એક પગથીથાં સર કરતો કર્માલીયતના દરજજા ઉપર પણોચી જાય છે અને દીને હક એટલે કે સાચા મજહબની પણ એ જ ઉપમા છે અને એ જ હેતુની પ્રાપ્તિ સાથે તાવીલી ધર્મયુદ્ધ જરૂરી છે.

(૯) અહીંથી એ સ્પષ્ટ છે કે શરીર્યતની સાથે સાથે તથા શરીર્યતના પછી પણ તરીકન, હકીકન અને મારફતની ડેળવણી ઉપર લોકોએ અમલ કરવાનો છે અને જો તેમાંગે એટલે કે લોકોએ આવતને નકારી દીધી તો પછી તેમના વિરુદ્ધ તાવીલી ધર્મયુદ્ધ જરૂર થશે.

અને તે એ હોંકે જમાનો અને દુનિયા તેઓના માટે પ્રકાર પ્રકારની મુશ્કેલીઓ ઉભી કરી દેશે.

(૧૦) આ હીસથી એ સત્ય પાગ પ્રકાશિત થઈને સ્પેચ વર્તાઈ આવે છે કે હજરત (સ.આ.સ.)ના પછી ઈમામે બરહ્ક (અ.સ.) કુરાખાનની ઘણીબધી (અસંખ્ય) તાવીલોથી સંખૂર્ગપણે જાગુકાર છે અને ઈમામે જમાનના વસીલાથી (ઇમામે જમાન મારફત) તે માનવત લોકો પણ તાવીલના સિદ્ધાંતને જાણે છે જેઓ દાવતના કેન્દ્ર એટલે કે મઝહબ ફેલાવા માટેના કેન્દ્ર અર્થાત વખતના ઈમામ (અ.સ.)ના તરફથી જાની અર્થાત ઈલ્મી ધર્મયુક્તના માટે નિયુક્ત થયેલાં હોય છે.

(૧૧) એ જાગુવું જોઈએ કે તાવીલના ત્રણ સ્થાનો છે. પહેલું સ્થાન કુરાખાન છે કે જ્યાં તાવીલ છુપાયેલાં અર્થે અને હિક્મતની હેરીયતમાં છે, દ્વિતીય સ્થાન ઈમામે જમાન અને તેમના વારસદારો છે કે જ્યાં તાવીલ રહુની અનુભવોના સ્વરૂપમાં મૌજૂદ છે અને ત્રીજું સ્થાન આ જાહેરી દુનિયા છે કે જેમાં તાવીલ મહાન પરિવર્તન અને અક્ષરમાતોના સ્વરૂપમાં નજરે પડે છે.

(૧૨) કુરાખાનમાં તાવીલ સંબંધે જે કંઈ ફરમાન ફરમાવેલાં છે તેમાં એક વાત એ પાગ છે કે તાવીલ કુરાખાનના નાજીલ થવા પછી ધરિ ધરિ આવનારી છે. આ માટે તપાસી જુઓ સુરહ ૭, અયત ૫૭ થા સુરહ ૧૦ આયત ૩૮. તેમાં એ સવાલ થઈ શકે છે કે શું કુરાખાને કરીમના નાજીલ થવાની સાથે સાથે તાવીલ નહોતી ઉત્તરી ? અને શું હજરત રસુલુખ્બાહ (સ.આ.સ.)ની પવિત્ર હસ્તી ઉપર તાવીલ નાજીલ નહોતી થઈ ? તેનો જવાબ એ છે કે ચોક્કસપણે કુરાખાનની

તન્જીલ એટલે કે કુરાનના ઉત્ત્વાની સાથે તાવીલ પાગ હતી અને હિન્દુ નબી સાહેબ (સ.અ.સ.) તાવીલને સૌથી પહેલે જાગૃતા હતા પાગ ત્રીજા સ્થાનની તાવીલ કે જેનો ઉલ્લેખ ઉપર થયો છે, તે હિન્દુ રસૂલુલ્હાભ (સ.અ.સ.)ના વખતમાં, હજુ સુધી આવી નહોતી, જે ધીરી ધીરી વખતના પરિવર્તનના રંગમાં જહેરમાં આવનાર હતી અને તાવીલના એ જ પાસા થકી ફરમાન થયું હતું કે “હમારા તાવીલ નથી આવી અને તે ભાવિષ્યમાં આવનાર છે. એ સિવાય તેમાં એ ઈશારો પાગ છે કે વ્યક્તિગત તથા સમુહગત સિથિતમાં રૂહાની વખતનું આવવું એ તાવીલનું આવવું છે.

(૧૩) તાવીલ જે પાગ સ્થાનની હોય, જે પાગ દરજજાની હોય પહેલાં તે દાવત એટલે કે આમંત્રણની હેસીયત ધરાવે છે. જો તેને કબૂલ ન કરવામાં આવી તો પછી તે યુદ્ધનું સ્વરૂપ ધારण કરી લ્યે છે, માટે તાવીલ એ બરહક ઈમામ (અ.સ.)ની દાવત પાગ છે અને તેનું યુદ્ધ પાગ.

and Luminous Science

Knowledge for a united humanity

દરજજાવાર હિંદાયત

પ્રત્યેક મુસ્લિમ વ્યક્તિ માટે એ એક કબૂલ કરેલી સર્ચાઈ છે અને તેમાં કોઈને કોઈ શંકા જ નથી કે ઈસ્લામ મજહબ ખુદાઈ અને કુદરતી મજહબ છે કેમકે ચોક્કસપણે, ઈસ્લામ જ એ એક માત્ર આસમાની એટલે કે (ખુદા તરફથી આપવામાં આવેલો) કુદરતી મજહબ છે કે જે ખુદાના ફરમાન મુજબ (૬૧/૮) આગળ જતાં જગતનાં સઘળાં મજહબોને પોતાના રંગ સાથે એક રંગ કરી દેવાવાળો (ભેળવી દેવાવાળો) છે. જ્યારે એ સર્ચાઈ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગઈ કે ઈસ્લામી હિંદાયતોની પરંપરા અદ્વાહ તાદાલાની એ કુદરતના પ્રમાણોની છે, કે જેના ઉપર તેણે સઘળા મનુષ્યોને પેદા કર્યા છે ત્યારે એનો અર્થ એ થયો કે ઈસ્લામી હિંદાયતોનું અમલમાં આવવું દરજજાવાર થાય છે, મતલબ કે, જો કે હિંદાયતનું નૂર તો સદા કાળથી મૌજૂદ છે પરંતુ તેમાંથી વખતો વખત - સમય પ્રમાણે - બદલાતાં સંજોગોની નવી જરૂરત પ્રમાણે તાજી હિંદાયતો બહાર પડતી રહે છે કે જેથી વર્તમાન સંજોગોના (નવા જમાનાના) કોયડાઓનો ઉક્લ આધુનિક રીતથી મેળવાય અને નવી મુશ્કેલીઓ ઉપર કાબૂ કરી શકાય, માટે અમો આ વિષય હેઠળ કુરાઓના પ્રકાશમાં એ સાબીત કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે એકદરે ઈસ્લામી હિંદાયતો દરજજાવાર રીતે છે.

દલીલ (૧) : “દીતરતદ્વાહીલતી દીતરનાસ અલેહા લા તબ્દીલલ ખલ્કીદ્વાહી જાલીકદ્વાનુલકૈયુમ.” ૩૦/૩૦. આ અદ્વાહ ઘડેલો સૃષ્ટિ નિયમ (દીતરત) છે કે જે નિયમ પર તેણે માગુસોને સર્જ્યા છે.

અવ્યાહના તે સૃષ્ટિ નિયમમાં કોઈ ફેરફાર થઈ શકો નથી. એ જ ધર્મ (સાચો ધર્મ) કાયમ છે.

આ પદ્ધતિ આયતમાં ફરજાવવામાં આવેલ છે કે લોકોને કુદરતી નિયમના પ્રમાણે પેદા કરવામાં આવ્યા છે અને તે નિયમમાં કોઈ ફેરફાર નથી અને ન તો આ સ્વચ્છામાં (આ પેદા કરવામાં) કોઈ ફેરફાર થઈ શકે છે, અને (હુમેશનો રહેતો) કાયમનો ધર્મ પણ એમ જી છે. આ રીતે અહીં એ જગ્યાયું કે ઈસ્લામ કુદરતી ધર્મ છે અને તેની હિદાયતો તબક્કાવાર સ્વરૂપમાં છે એટલે કે તેની હિદાયતો એક એક કરીને દરજજાવાર ધીમે ધીમે આગળ વધતી જાય છે.

ઇલીલ (૨) : સુરહ અન્યામમાં (૬/૭૫થી ૭૮) જ્યાં હજરત ઈબ્રાહિમ (અ.સ.)ને આસમાનો અને જમીનની રૂહાનીયતના અનુભવ કરાવવાનો ઉદ્દેખ મૌજૂદ છે, તેનાથી એ સર્વાઈ સાંચ રીતે સામે આવે છે કે ખુદાની હિદાયત દુનિયાવાળોને દરજજાવાર આપવામાં આવે છે, જેમકે હજરત ઈબ્રાહિમ (અ.સ.)મે પહેલાં એક સીનારા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું પછી ચંદ્ર ઉપર એક ધ્યાન થતા રહ્યા તે પછી સૂર્યના વિષે વિચારવા લાગ્યા અને છેવટમાં ખુદાવંદના તરફ ધ્યાન મળ થયા. આ એ પ્રસંગનું તન્જીલી સ્વરૂપ થયું અને તેનું તાવીલી સ્વરૂપ એ છે કે સીનારા, ચંદ્ર અને સૂર્ય હદ્રેશીન છે, જેના વસીલાથી, (જેના મારફત) હજરત ઈબ્રાહિમ ખલીલુદ્દીલ ખુદાની મારફતને પહોંચી ગયા અને તેમને આપવામાં આવેલી આ હિદાયત દરજજાવાર સ્થિતિમાં હતી, એટલે કે ધરિ ધરિ નવી નવી હિદાયતો ઉપર અમલ કરવાની રીત કર્મ કરતી હતી.

દ્વીપ (૩) : સુરહ બકરહની બીજી તુલમાં ઈશારે આપવામાં આવેલ છે કે મનુષ્ય ધર્મની પ્રગતીના રસ્તા ઉપર એક એવો મુસાફર છે, જે રાત્રીના અંધારામાં ડાલે ડાલે પ્રકાશની નવી નવી ક્રીરગોનો જરૂરતમંદ રહે છે. તેને રસ્તો દેખાડવાને માટે એવા નૂરની (પ્રકાશની) જરૂરત છે કે જે દર પણ તાજી નૂરની ક્રીરગોની એકધારી વર્ષા કરતું રહે અને જો તેથી વિરુદ્ધ, પ્રકાશ એવો હોય કે જે ક્યારેક અકાશિત થાય અને ક્યારેક બુજાઈ જાય તો એવા પ્રકાશમાં મુસાફર ફક્ત અમૃક ડગલા જ આગળ વધીને રોકાઈ જાય છે, જેમકે આકાશી વિજયીના ચમકવાનો પ્રકાશ છે અને જેમ ક્રોઈ એક જગ્યાએ પડી પડી બળી રહેલી આગનો પ્રકાશ છે. આ ઉપમા થકી એ જાગ્યાય છે કે પવિત્ર કુરાનામાં હીદાયતના જે નૂર અને પ્રકાશના વખાંગ અને પ્રસંશા કરવામાં આવેલ છે તે દરજજાવારની હીદાયતનું અનંત જરાણું છે.

દ્વીપ (૪) : સુરહ હ્યેદ (૫૭)ની આયત રટમાં જરાક ધ્યાન આપવાથી જાગ્યાય છે કે ક્રોઈ વ્યક્તિ અને ક્રોઈ સમુદ્ય સીરાતે મુસ્તકીમં ઉપર, ખુદા અને રસૂલ (સ.અ.સ.)એ જે નક્કી કરેલ છે તે હિદાયતના નૂરના પ્રકાશના સિવાય મજબૂતપણે ચાલી નથી શકતા. આનો અર્થ એ થયો કે દુનિયા અને જમાનામાં દીન અને મજહબ એક રસ્તા જેવા છે કે જે ઉપર ચાલનારાઓને હિદાયતના તાજા અને નવીનતર પ્રકાશની જરૂરત હોય છે કે જે આસપાસની દરેક વસ્તુઓને જાહેર કરી શકે કે જેથી મજહબનો મુસાફર સમય અને જગ્યાના સંજોગો જાગુવાથી દૂર ન રહે (અંધારામાં ન રહે) અને ધારેલી મંજીલ તરફ આગળ વધી શકે. (ડગલાં માંડી શકે).

દલીલ (૫) : પવિત્ર કુરાનની સુરહ (૬/૧૨૩)માં છે કે “શું તે માનવી કે જે મડું હતો, પદી તેને અમે સજ્જવન કર્યો તથા તેને અમોએ પ્રકાશ આપ્યો કે જેના કારણે લોકોમાં હેર ફરે છે, તે એવા માનવી જેવો છે કે જે અંધકારમાં હોય અને તેમાંથી બહાર નીકળી શક્તો ન હોય.

આ મુખ્યાક આયતમાં એ શિખવવમાં આવ્યું છે કે આ ભૌતિક જગતમાં મજાહબી છંદગી ગુજારવા અને યોગ્ય અર્થમાં જીવંત થઈ જવાને માટે એક વ્યક્તિને ખુદાતાલાની જે હિંદાયત તથા રહેમતની જરૂરત છે તે જ હિંદાયત અને રહેમત સમગ્ર જગતને માટે જોઈએ નહીં તો અહીં મડદાપાણું અને અંધકાર સિવાય કંઈ નથી એટલે કે આ જગતમાં ખરા અર્થમાં જીવંત ફક્ત અને ફક્ત તે જ લોકો છે કે જેમને અદ્વાહિતાલાએ જ્ઞાન અને મારફતની રૂહમાં સજ્જવન કરી દીધા છે અને તેમને પોતાના હિંદાયતના નૂરથી સંબંધિત કરી દીધા છે. આ અર્થમાં જરા ધ્યાન આપવાથી એ પરિણામ નિકળે છે કે જગતમાં ન ફક્ત ગઝલત એટલે કે ભૂલ અને અજ્ઞાનતાની મૌત અને અંધકારના સાધનો સંદર્ભને માટે મૌજૂદ અને પ્રાપ્ય છે પણ તેની સામે ઝીકર અને મારફતની છંદગીનો વસીલો અને નૂરનું સાધન પણ હુમેશને માટે ચાલતું રહે છે. જો એમ ન હોત તો જ્ઞામતના દિવસે ખુદાતાલા સામે લોકોને ફરીયાદ હોત અને કૃહેવામાં આવતે કે “પરવરદીગાર ! દુનિયામાં અંધકાર જ અંધકાર હતો અને કોઈ પ્રકાશ નહોતો.”

આ ઉપરથી એ સત્ય બાબત સામે આવી કે દુનિયામાં હિંદાયતનું નૂર હૈયાત અને હજર છે અને તે એ માટે છે કે આરીએ

એટલે કે ખુદાને ઓળખનાર બંધો તેની જ હિદાયતના પ્રકાશમાં દીની તથા દુન્યવી જુંગીના પગથીયાઓ (વિવિધ ક્ષેત્રો) શાંતિ અને સલામતી સાથે પસાર કરે કે જેથી આ મુસાફરી દરેક પ્રકારે જોખમ વગરની અને સફળ થઈ જાય, જેમકે ઉપર ઉદ્દેખાયેલી આયતમાં સ્પષ્ટ છે કે નૂર એ માટે હોય છે કે તેના પ્રકાશમાં તકલીફ અને જોખમોથી સુરક્ષિત રહીને સીધા રસ્તા ઉપર ચલાય અને ધારેલી મંજીલ સુધી પહોંચાય અને તે જ વસ્તુનું નામ છે દરજજાવારની હિદાયત.

દલીલ (૬) : કુરઆને શરીરની સુરહ (૬૭/૨૨)માં છે કે “મલા જે પોતાનું મોહું નીચું ધાલીને ઊધા મોઢે ચાલી રહ્યો હોય તે વધારે હિદાયત મેળવેલો છે કે જે સરખો ઊભો રહી સન્માર્ગ ચાલી રહ્યો હોય તે.”

આ આયતમાં સીધા માર્ગ ઉપર ચાલવા અને તેનાથી ભટ્કી જાણાના વચ્ચે જે તકાવત જોવામાં આવે છે તેની ઉપમા આપવામાં આવી છે. આ ખૂબ જ ગંભીર ભાવે વિચારવાની વસ્તુ છે કે જો એક મનુષ્યને ધારેલી મંજીલનો માર્ગ નથી મળી રહ્યો અને વધુમાં કમનસીબી એ છે કે તે એક સશક્ત માણસની જેમ ચાલી પણ નથી શક્યો તો તે ઊધા મોઢે ચાલીને જ્યાં સુધી પહોંચી શકે છે ? અને તે અસફળ પ્રયત્નો તથા દ્શયદા વગરની તકલીફ સહન કર્યો સિવાય બીજું શું કરી શક્યો ? જેનો અર્થ છે ભટ્કી જવું, રૂહાની પ્રકારની નાખુશી અને અજાબ (ખુદા તરફથી મળનાર તકલીફ), અને તેની સામે છે હીદાયત, રાહત (શાંતિ) અને સવાબ.

જ્યારે અદ્વાહતાલા પોતે હલકાપાગાને (નીચતાને) વખોડે છે

અને તેમ છાં ન્યાયના નિયમને હિસાબે નીચતા અને ગેરમાર્ગ ભટકાઈ જવાના સાધનોની જરાય ઓછાપ નથી તો પછી એ કેમ શક્ય થઈ શકે છે કે જે હિદાયત જગતના પાલનહાર (પરવર્દીગાર)ના રજીપાઠી સંબંધ રાખે છે તેના સાધનો સંપૂર્ણ (યોગ્ય પ્રમાણામાં) ન હોય, અથવા ક્યારેક સંપૂર્ણ થવા પછી કરી તેનામાં કંઈક ઘટાડો કરવામાં આવ્યો હોય, એમ તો હરગીઝ નથી થઈ શક્યાનું આ વર્ગનનો ખુલાસો એ છે કે ગેરમાર્ગ ભટકાઈ જવાના રસ્તા શરૂઆતથી જ છે અને મનુષ્ય માટે ઘણી વખત કોઈ નવો કોયડો ગેરમાર્ગ ભટકાઈ જવાનું કરારણ બની જાય છે, તે જ પ્રમાણે બીજી બાજુએ હીદાયત પાગુ શરૂઆતથી જ છે અને હિદાયતના સાધનનું જરૂરી કાર્ય એ છે કે તે તે સામે આવનાર નવીન મુસીબત ઉપર હીદાયતનો નવીન અને તાજો પ્રકાશ નાંખે છે, જેવી રીતે કોઈ મુસાફર જ્યારે અંધારી રાતાં કોઈ પ્રકાશને સાથે લઈને પ્રવાસ કરે છે ત્યારે પ્રકાશને પોતાનાથી પાછળ નથી રાખતો પાગુ તે તેને આગળ અને આગળ લઈને જાય છે કે જેથી પ્રત્યેક નવા ડા. ભરતાં પહેલાં માર્ગ ઉપર (પગંડી ઉપર) નવો પ્રકાશ નાંખે અને તે શાંતિ અને સલામતી સાથે ધારેલી મંજીલ ઉપર પહોંચે.

દ્વાલિલ (૭) : સુરહ અહાબ (૩૩)ની આયત નંબર દરમાં ફરમાવેલું છે કે “અક્ષાહનો આ એ જ નિયમ છે કે અગાઉ થઈ ગયેલા લોકોમાં પાગ ચાલુ હતો અને તું અક્ષાહના નિયમમાં કંઈ પાગ ફેરશર હરગીઝ જોશે નહીં” આનો અર્થ એ થયો કે ખુદાની આદન અને પ્રથાનો સંપૂર્ણ નમૂનો હજાત નબી સાહેબ (સ.અ.સ.)થી પહેલાંના વખતમાં પસાર થઈ ચુક્યો છે અને હવે નબુદ્વતના સમયથી લઈને

ક્યારે સુધી અક્ષાહની એ જ આદત કોઈ પાગ ફેરશાર વીના ચાલતી રહેશે તે એ કે લોકો માને કે ન માને પાગ દેંક હાલતમાં હીદાયતના નૂરની દરજજાવાર ક્ષયદો પહોંચાડવાની રીત જગતમાં ચાલતી રહેશે અને સમય તથા સ્થળની જરૂરત મુજબ હીદાયતનો પ્રકારા શક્ય હેતુ મળતો રહેશે.

દલીલ (૮) : સુરહ બકરહની આયત (૨૬૮)ને સામે રાખીને આપણે એ ખુલાસો કરીશું કે જો હિક્મત ઈજ્ઞ અક્ષાહની મરજી - અક્ષાહની ઈચ્છાથી કોઈને મળી શકે છે અને તે મળવામાં ખૂબ વધારે ભલાઈ (સારાપણું) છે તો સમજ લેવું જોઈએ કે એ હિક્મત અને ખૂબ વધારે ભલાઈ, એવી દરજજાવારની હીદાયતના સ્વરૂપમાં છે કે જ સમય અને જર્યા (સ્થળ)ની જરૂરત પ્રમાણે મળતી રહે છે.

દલીલ (૯) : સુરહ ઇતહના છેવટના ભાગમાં એક અત્યંત મહત્વનું ફરમાન છે જેનો સાર એમ છે કે અક્ષાહતઆતાએ પોતાના રસૂલ (સ.અ.સ.)ને સંપૂર્ણ હીદાયત તથા દીને હક એટલે કે સત્ય ધર્મની સાથે મોકલ્યો કે જેથી સત્યધર્મ એટલે કે ઈસ્લામને જગતના સધળા ધર્મો ઉપર ભારે એટલે કે છિંઘાઈ જનાર બનાવી દેવાય. કુરાઓનમાંની આ ભવિષ્યવાણીથી એ સર્યાઈ સંપૂર્ણપણે પ્રકાશિત થઈ જાય છે કે ઈસ્લામ ધર્મની સૌથી મૂળભૂત અને સૌથી મહાન શક્તિ કે જે સર્વ જગત ઉપર ફેલાયેલી છે તે હીદાયત તથા સર્યાઈ જ છે (જેમકે “બીલ હુદા વ દીનીલ હક્કી - હીદાયત તથા સત્ય ધર્મની સાથે - ઉપરથી સ્પષ્ટ છે) અને આ રૂહાની શક્તિ નબુઝ્યતના મરતબાના પછી ઈમામતના દરજજાના ઊરણા દ્વારા સદા તાજગી ભરી અને નવીનતમ (હીદાયત) અમલમાં આવીને જગતના ધર્મને ધીર ધીર

ખુદાઈ ધર્મનો એક જ રસ્તો અને એક સંપી અર્પણ કરશે.

દલીલ (૧૦) : કુરાનમાં સુરહ દ આયાત ૮૧માં ફરમાવેલું છે કે હજુત પયગમ્બર સાહેબ (સ.અ.સ.) તમો પાણ તમારા પહેલાં થઈ ગયેલાં અંભીયાઓની એકદર હીદાયતનું અનુકરણ કરો. આનો અર્થ એમ હરગીજ નથી કે (નઉજિબિદ્વાહ) હજુત પયગમ્બર સાહેબ (સ.અ.સ.) કુરાનને છોડી દઈને પાછલા પયગમ્બરોની હીદાયત ઉપર અમલ કરે બલ્કે આનો અર્થ તો એ છે કે નબીઓના સરદાર (સ.અ.સ.) કુરાનના જ સ્વરૂપમાં ગુજરી ચ્યુક્લાં સમયના પયગમ્બરોની હીદાયતનું અનુકરણ કરે કેમકે અદ્વાહનઆલાએ અન્ય સઘળા અંભીયાઓ (અ.સ.)ને એકદર રીત જે હીદાયત આપી હતી તે હીદાયત કુરાનના નાજીલ થવા અર્થાત તન્જીલ તથા તાવીલની હુદમાં જ છે (તે હુદથી બહાર નથી) વળી એનો અર્થ એમ થમો કે નબુવ્યતના સમયથી લઈને જ્યામત સુધીના સમગ્ર કાળને માટે અદ્વાહનઆલાના તરફથી જે હીદાયત નક્કી કરેલી છે તે સમય અને સ્થળની નવી જરૂરતો પ્રમાણે દરજજાવારના સ્વરૂપમાં છે, જેમકે હજુત મોહંમદ પયગમ્બર (સ.અ.સ.)થી પહેલાંના અંભીયાઓની હીદાયત વખતના બદલવા (ફરજિયાત)ની સાથે સાથે આગળ વધતી રહી હતી.

દલીલ (૧૧) : કુરાનમાં આવેલું છે કે “કાલ હાજા સીરાતુન અદ્વા મુસ્તકીમ” (૧૫/૪૧) અર્થાત (ખુદાએ) ફરમાવ્યું કે આજ (એક જ) સીધો માર્ગ છે જે મારી તરફ (મારા સુધી) પહોંચે છે.

અહીં એ અર્થ સ્પષ્ટપણે જાહેર થઈ જાય છે કે સત્ય ધર્મ એટલે કે ઈસ્લામ જ તે સીધો માર્ગ છે કે જેના મારુફત લોકો ખુદા

સુધી પહોંચી શકે છે અને આજ તે સીધો રસ્તો છે જેણી હીદાયતનો આરંભ હજસ આદમ (અ.સ.)મે કર્યો અને દરેક પયગમબરે પોતપોતાના સમય પ્રમાણે આ ખુદાના માર્ગની હીદાયત આપી, ત્યાં સુધી કે જ્યાં સુધી હજસ મોહંમદ પયગમબર (સ.અ.સ.)નો સમય આવ્યો અને તેવાળ નામદાર (સ.અ.સ.)મે પોતાની હૈપાતીમાં તે સમયના પ્રમાણે મુસલમાનોને હીદાયત તથા માર્ગદર્શન આયા અને ભવીષ્યની એ જ દરજજાવારની હીદાયતના માટે હજસ નબી સાહેબ (સ.અ.સ.)મે ખુદાના હુકમથી પોતાનો જાંતશીન એટલે કે વારસદાર નિયુક્ત ફરમાવ્યો અને આ કમ ક્યામત સુધી ચાલતો રહેશે. આથી જાગ્રાયું કે ખુદાના તરફથી લોકોને માટે જે દીની અને દુન્યવી હીદાયતનું કેન્દ્ર નિયુક્ત કરવામાં આવ્યું છે, તે સમય અને સ્થળની જરૂરીયાત પ્રમાણે દરજજાવારની હીદાયતનો પ્રકાશ ફેલાવે છે.

દલીલ (૧૨) : પવિત્ર કુરાનમાં ફરમાવવામાં આવેલ છે કે “ઓ ઈમાન લાવનારાઓ તાબેદારી કરો અદ્વાહની, તાબેદારી કરો રસૂલની અને તાબેદારી કરો (અદ્વાહના હુકમવાળાઓની (ઉલીલ અમ્રની) કે જે તમારામાંથી છે (૪/૫૮).

એ એક એવી આજ્ઞા છે કે જે નબુવ્યતના સમયથી લઈને ક્યામત સુધી પેદા થનારા ઈમાનવાળાઓને સામે રાખીને ફરમાવવામાં આવેલ છે અને તેનો છેતુ એ છે કે ખુદાની ફરમાંબરદારી રસૂલના મારફત કરવામાં આવે અને રસૂલ (સ.અ.વ.)ની ફરમાંબરદારી ચાહું અમાનાના (પોતાના સમયના) ઈમામના મારફત બજાવી લાવવામાં આવે, (સમયના) વખતના ઈમામની તાબેદારીનો સ્પષ્ટ ઈશારો

“મીનકુમ”માં મૌજૂદ છે.

આ ઉપરથી સધળા સમજદાર (જ્ઞાની) લોકો ઉપર એ સર્વાઈ સ્પષ્ટ થઈ જાય છે કે જો દરેક મનુષ્ય પોતે પોતે જ કુરખાનની હીદાયતનું સમજી લેતે તો ફરમાવવામાં આવ્યું હોતે કે તમો ફક્ત અદ્ધાહની તાબેદારી કરો અને બસ. અને તેમાં રસૂલ (સ.અ.સ.)ની તાબેદારીની ક્રોઈ આજ્ઞા ન હોત, વળી જો રસૂલ (સ.અ.સ.)ની હીદાયત પછી અન્ય ક્રોઈની હીદાયતની જરૂર નહીં હોતે તો એવી આજ્ઞા હરગીઝ ન દેવામાં અંવતે કે હુકમના માલીકની તાબેદારી કરો અને તે જ પ્રમાણે અમુક શરૂઆતના ઈમામો (અ.સ.)ના પછી ઈમામત અને હીદાયતનો કુમ અંત પામી જાત અથવા જમાનાના ઈમામની હીદાયતમાં ક્રોઈ નવી વાત ન હોત અને લોકોને જાહેરીમાં એવો સવાલ ક્યારે ન ઉદ્ભવતે કે “પાછલા ઈમામોની હીદાયત કરતાં હાજર ઈમામની ફલાણી હીદાયત જુદી છે, હવે કોના ઉપર અમલ કરવામાં આવે.” તો એવી સ્થિતિમાં ખુદા એમ ન ફરમાવતે કે તમો આવી મતબેદની સ્થિતિમાં પોતાના જ વખતના એટલે કે હાજર જમાનાના ઈમામની તાબેદારી કરો (તેની આજ્ઞા માનો).

દ્ધીલ (૧૩) : ખુદાવંદ તાચાલાનું ફરમાન છે કે “હલ યન્ગુરુન
ઇલ્લા તાવીલહુ યૌમ યઅતી તાવીલહુ યક્કૌલુલ્લઝીન નસુહુ મીન કષ્ણુ
ક્ષ જાઅતરસુહુ રબ્બીના બીલહક્કી ફહુના મીન શુફ્ખા ઇ યશશુલના
ઓનુદુ ઇ નઅમલ ગૈરખજી કુના નઅમલુ. (૭/૫૩).

“શું તે લોકો માત્ર તેની તાવીલની ક્રોઈ વસ્તુના આવવાની)
વાટ જુએ છે. જે દિવસે તેની તાવીલ (તેનું પશિગુામ) આવશે તો તે

લોકો જેઓ તેને પહેલેથી જ વીસરી ગયા હતા, તેઓ કણો કે બેશક અમારા પરવરદીગારના રસૂલો સત્ય લઈને આવ્યા હતા પછી શું કોઈ અમારા માટે પાગુ શકાયત ડરનારો છે જે અમારી શકાયત કરે અથવા અમને પાછા મોકલી દેવામાં આવે કે જૈથી જેવા કાર્યો (કુ કર્મો) અમો કર્યા કરતા હતા તેની વિરુદ્ધના કાર્યો (સંકર્મો) કરીએ..."

કુરાનની આ આયતનો સ્પષ્ટ અર્થ એ છે કે દુનિયા અને જમાનાના નવા નવા પ્રસંગો તથા અક્સમાતો તથા છેખામાં છેખી જરૂરિયાતોના પરિણામે કુરાનની તાવીલી હીદાયતને પ્રકાશ દ્વારા મતની પરંપરા દ્વારા દરજજાવાર ફેલાતો રહેશે અને પરિણામ રૂપે એક હિસ્સ આ જગતમાં ફેલાતોની એક મહાન ક્ષયામત વિનશે જેને સિદ્ધાંતિક રીતે ક્રન એ જ લોકો સહન કરી શકો જેઓ આરંભથી જ - શકુઅતથી જ કબૂલ કરતા આવ્યા છે.

દલીલ (૧૪) : સુરહ યુનુસ (૧૦/૩૮)માં છે કે "જલ્દે તેઓએ તેને (અર્થાત કુરાનને) કબૂલ ન કર્યું એ માટે કે તેઓ તેના જ્ઞાનને પહોંચી નથી શક્યા અને જેનો ખરો અર્થ (જેની તાવીલ) હજુ તેમની પાસે પહોંચી નથી.." કુરાનની આ આયતમાં પાગુ હિકમતની ભાષામાં એ જ ઇમાવવામાં આવેલ છે કે પહેલાં તો કુરાનની તન્જીલ એટલે કે કુરાનનું નાંજીલ થવું સંપૂર્ણ થયું છે અને તેના પછી ધરિ ધરિ તેની તાવીલ (તેના અર્થ) જાહેર થતી ચાલી જાય છે અને જો કુરાનની પ્રત્યેક આયતની તન્જીલમાં જો એક ભાગ હીદાયત છે તો તેની તાવીલમાં સીતેર હીદાયત છે, એ જ રીતે કુરાનના બાતિનમાં અગ્રણિત હીદાયતો છે જે કોઈ એક જ વખતના

માટે નથી પરંતુ પૂરા યુગ - પૂરા જમાના માટે છે. આ પરથી એ સત્ય સ્પષ્ટ થયું કે જાહેરીમાં તથા બાતિનમાં કુરાખાનની હીદાયતો કુમવાર અને દરજજાવાર છે કે જેને દરજજાવારની હીદાયત કહે છે.

દલીલ (૧૫) : તન્જીલ અને તાવીલની આ અતીધારી આસમાની હીદાયતના પ્રકાશમાં ખૂદા અને રસૂલ (સ.અ.સ.)નો ખલીશી દીન મજાહબના કાર્યોનો સત્તાધિકારી હોય છે, એ માટે કે અદ્વાહ અને તેના રસૂલ (સ.અ.સ.)મે તેને (સાહેબે અમ્ર) હુકમનો માલીક ગણ્ણાવ્યો છે અને સ્પષ્ટ છે કે હુકમનો માલીક સર્વ સત્તાનો અધિકારી હોય છે અને ખલીશનો પાણ એ જ અર્થ છે કે ખલીશ જાનશીન અર્થાત વારસદારને કહે છે અને અહીં “જાં”નો હેતુ એટલે કે અર્થ છે મરતબો અને અધિકાર અને આનો અર્થ ક્રેદ જાહેરી કે લૌનિક પ્રકારની જગ્યા કે સ્થળનો નથી જેમકે ફરમાવેલું છે “યા દાઉદ ઈના જાંલનાક ખલીશ્તુન કીલ અર્જી ઈ છૂદુમ બેનનાસી બીલ હક્ક” (૩/૨૬).

અર્થ : હે દાઉદ ! ચોક્કસપાણે અમોએ તને ધરતી ઉપર (અમારો) પ્રતિનિધિ એટલે કે ખલીશ બનાવ્યો છે માટે તું લોકો વચ્ચે ન્યાયસર ચૂક્કાદી આપતી રહે. આ પરથી સ્પષ્ટ થયું કે હજારત દાઉદ (અ.સ.) પોતાના વખતમાં ખૂદા અને તેના એ પયગમ્બરો કે જેઓ તેનાથી પહેલાં થઈ ચૂક્યા હતાં તેના સર્વસત્તાધારી ખલીશ હતા કારણ કે જો ખુદાતાલા પોતે જ દરેક બાબતનો ફેસલો કરતો હોત અને ખુદાના ખલીશને તેમાં ક્રેદ અધિકાર જ ન હોત તો એમ ક્યાસેય ન ફરમાવ્યું હોત કે લોકોની વચ્ચે ન્યાયસર ચૂક્કાદી કરજે. આ દલીલથી એ પૂરવાર થાય છે કે દરેક જમાનાનો ઈમામ જે પોતાના સમયમાં અદ્વાહ તથા રસૂલ (સ.અ.સ.)નો ખલીશ છે તે દીની કાર્યોમાં સત્તાધિકારી હોય છે

અને તેની હીદાયત દરજજાવારની હીદાયત હોય છે.

દલીલ (૧૬) : અધ્યાહ તથાલાનું ફરમાન છે કે “અને જ્યારે તેમને શાંતિ અથવા ભયની કોઈ વાત માલુમ પડી જાય છે, ત્યારે તેઓ તેને સર્વત્ર ફેલાવી દે છે પણ જો તેઓ તે વાતને રસૂલ સામે અને તેઓમાંથી જે (અધ્યાહના) સત્તાધારી છે તેની સામે રજૂ કરી દેતે તો તેઓમાંથી જેઓ વાતના ઊડાણમાં પહોંચી જનારાઓ છે તેઓ તેને (તેની સર્વ્યાઈન, જાહી દેતે. (૪/૮૩).

ખુદાના આ ફરમાનમાં એ હીકમત છે કે ખુદાના રસૂલ (સ.અ.સ.)ના પછી ફક્ત (ઉલીલ અમૃ) હુકમના માલીકો જ છે કે જેણું કુરાનની આયતોમાંથી કાઢી આપીને મજહબની આજ્ઞાઓનો ખુલાસો તથા સમયની સ્થિતિ મુજબ લોકોને હીદાયત તથા માર્ગદર્શન આપી શકે છે. હુકમના માલીકો એટસે કે પવિત્ર ઈમામો (અ.સ.)ના માટે જ (ખુલાસો) કાઢી આપવાનું ખાસ ઠેખેલું છે એનો અર્થ એ જ છે.

દલીલ (૧૭) : કુરાનની સુરહ ૩, આયત ૧૮માં ફરમાવેલું છે કે “ઇન્નદીન ઇન્દ્રાહીલ ઈસ્લામ” અર્થात, ચોક્કસપણે અધ્યાહ તથાલાની પાસે (સાચો) દીન ઈસ્લામ જ છે. વળી એનો અર્થ એમ પણ છે કે ચોક્કસપણે ખુદા પાસે (ખુદાને જે કબૂલ હોય તે) દીન એ છે કે ખુદાવંદી હુકમનો સદાય સ્વીકાર કરી દેવામાં આવે, કે જે પયગમ્બર તથા ઈમામની હીદાયત (તેમના બતાવેલ સાચા રસ્તા)ના માર્કન્ટ જ શક્ય છે. જેનો અર્થ એમ થયો કે દીની હીદાયત તુરતાતુરત

અથવા ક્રજ એક જ વેળાએ અને એકાએક રીતે નથી અપાતી પરંતુ જેની પરંપરા - તેનો કમ ચાલતો જ રહે છે, અને એ જ કારણ હતું કે દીને મુહૂર્મધી અર્થાત મુહૂર્મદના દીનને ઈસ્લામનું નામ અપાણ જેનો અર્થ છે, એવો મજહબ - એવો દીન કે જેના ન ક્રજ મૂળમાં અને અસાલમાં જ સ્વીકાર કરી લેવાનું અને ઇરમાંબરદારી જરૂરી છે પરંતુ જેમાં તો દેશ પળે ચાલતી રહેતી હીદાયતની તાબેદારી જરૂરી અને ઇરજીયાત હોય છે.

દિલ્હીલ (૧૮) :- અદ્ભુત તચાલાનું ઇરમાન છે “દ્વારા વ રજ્જીક લા યુઅમીનૂન હતા યુહકીમુક દીમા શજર બૈન હુમ સુમ્મ લા યજદઉ દી અનકુસીહીમ હરજમીમા કાઈન વ યુસ્લીમુ તરસીમા” (૪/૬૫). અર્થ : પાગુ તેવું છે જ નહી (અય રસૂલ) તારા પરવર્તીગારની કસમ એ લોકો જ્યારેય મોમીન નહી થશે જ્યાં સુધી કે તે અધડાઓમાં કે જે તેઓની વચ્ચે પડ્યા છે (તેના નિર્ણય માટે) તને ન્યાય કરનાર એટલે કે સરપંચ નથી બનાવી લેતા, પદ્ધી તું જે કંઈ ચુક્કાઓ આપે તેનાથી તે પોતાના મનમાં લેશ માત્ર પાગ ઓછું લાવે નહી અને તે (ચુક્કાનો) સંપૂર્ણ સ્વીકાર કરે.

આ હિકમત સભર આયત થકી સ્પષ્ટ થાય છે કે અધડો અથવા વિવાદ ખપે દીની હોય કે દુન્યવી, દેશ સ્થિતિમાં તેના ચુક્કાદા (તેના ન્યાય) માટે સાચા હાઈની સામે રજૂ થવું જોઈએ અને તે (હાઈ) જેવી પાગ આજા કરે તેને દીલોજાનથી કબૂલ કરવી જરૂરી છે, તેના વગર ઈસ્લામ અને ઈમાન અશક્ય છે.

દ્વિતીય (૧૮) : કુરમાનમાં છે કે "...જેથી કરીને હું ભારી નેયમતો તમારા ઉપર પૂરી કરી દઉ અને એ માટે કે તમો હીદાયત મેળવેલ બની જાઓ, જેવી કે અમોએ તમારામાંથી એક રસૂલ તમારામાં મોકલ્યો, જે અમારી આયતો તમને વાંચી સંભળવે છે તથા તમને પવિત્ર કરે છે અને તમને કીતાબ તથા છિકમત (ખરું ખોટું પારખવાના જ્ઞાન)નું શિક્ષાગ્રાહારી આપે છે અને જે તમે જાગુના ન હતા તે તમને શીખવાડે છે. (૨/૧૫૦-૧૫૧).

ખુદાના આ ઇરમાનમાં ખૂબ ખુલાસા સાથે એ ઈશારે ઇરમાવવામાં આવ્યો છે કે જે પ્રમાણે નબુદ્ધતના સમયમાં દીની અને દુન્યવી હીદાયતનો કુમ ચાલુ હતો તે જ પ્રમાણે ઈમામતના યુગમાં પાણ આ કુમ ચાલતો અને બાકી રહેશે. અને હીદાયતના કાર્યમાં કોઈ ઓછા નહીં આવે જે માટે ઇરમાવવામાં આવ્યું કે "...અને જેથી કરીને હું તમારી ઉપર મારી નેયમતો પૂરી કરી દઉ (એટલે કે વિલાયત અને ઈમામત કે જે ખુદા તરફાલાની ખાસ ન્યામતો છે) અને એ માટે કે તમો હીદાયત પામેલા બની જાઓ (એટલે કે ઈમામ અને ઈમામતનો હેતુ જ હીદાયત છે) તે પછી ઉપમા આપીને ખુદા ઇરમાવે છે કે જે રીતે રસૂલુદ્દ્વારા (સ.અ.સ.)ની મુખારક હસ્તી થડી પ્રકાર પ્રકારના રૂહાની તથા જીસમાની શાયદાઓ તથા બર્કતો મળે છે, તે જ રીતે ઈમામની પવિત્ર હસ્તીથી પાણ જ્ઞાન અને છિકમત તથા સરળતા, નેકી અને હીદાયતનો શાયદો મળતો રહેશે.

દ્વિતીય (૨૦) : સુરહ નૂર (૨૪/૩૫)ના છિકમત સભર ભાગોમાંથી એક ભાગ "નૂરનાંભતા નૂર" છે અર્થાત તે નૂર ઉપર નૂર

છે એટલે કે એક ઈમામ પદ્ધી બીજો ઈમામ થતો રહેશે અને એ જ રીતે જ્ઞાન તથા હિંમત અને નેકી તથા હીદાયતનો એક યુગ પદ્ધી બીજે યુગ ચાલતો રહેશે, અને ખુદાતાત્ત્વા તરફથી જગતમાં જે હીદાયતનું નૂર નિયુક્ત થયેલ છે તે એક પદ્ધી બીજા અંભીયા અને ઈમામો (અ.સ.)ની પવિત્ર હસ્તીની પરંપરામાં કાયમ રહેલ છે. આ પવિત્ર ક્રમની દેશક વ્યક્તિ પોતાના વખતનો સાચો હાઈ હોય છે. જેની હીદાયત પર ચાલવું જમાનાવાળાઓ ઉપર વાળું હોય છે. આ પરથી જીગાયું કે ઈસ્લામ મજહબની હીદાયત દરજજાવાર હીદાયતના સ્વરૂપમાં છે.

Institute for Spiritual Wisdom and Luminous Science

Knowledge for a united humanity

કુરબાનીની હિક્મત

કુરબાનીના શબ્દને દ્ધૂટું પાડીએ તો જગાશે કે આ શબ્દ કુરબાનથી છે અને કુરબાન કુર્બથી નિકળ્યું છે જેનો અર્થ છે નજીકી એટલેં નજીક થવું. કુરબાનનો અર્થ છે પ્રચેક તે વસ્તુ કે જેના થકી અખાહતઆલાની નજીક થવાય અને સામાન્ય ભાષામાં કુરબાન અને કુરબાની તે જાનવરને કહે છે જેને ખુદાના નામ પર ઝુલેહ કરવામાં આવે (જેના ઉપર દ્ધૂરી ચલાવવામાં આવે.)

કુરાનમાં હજરત આદમ (અ.સ.)ના સમયથી સંબંધ રાખનાર કુરબાનીનો ઉલ્લેખ આ મુજબ આવેલો છે : “અને (અય રસૂલ !) તમો તેઓને આદમના બે દીકરાઓનો પ્રસંગ બરાબર રીતે વાંચીને સંભળાવો, જ્યારે કે બંન્નેએ એક એક કુરબાની રજૂ કરી અને તેમાંથી એકની કબૂલ થઈ અને એકની કબૂલ ન થઈ, તો તે બીજો કહેવા લાગ્યો કે હું તને જરૂર કનલ કરીશ, તો તે પહેલાંએ જવાબ દીધો કે અખાહ તાથાલા તો ઈકન પરહેઝગારેનો જ અમલ કબૂલ કરે છે (૫/૨૭).

અહી એ સત્ય સપણપણે પ્રકાશિત થયું છે કે તકવા એટલે કે પરહેઝગારી ન ઈકન કુરબાનીની જ સૌથી મોટી શરત છે પરંતુ દેશ તે નેક કાર્ય કે જે પરહેઝગારી વગરનું હોય, તે ખુદાની દરગાહમાં જરા પણ સ્વીકાર્ય નથી હોતું.

કહેવામાં આવે છે કે હજરત આદમ (અ.સ.)ના ઉપરોક્ત બે દીકરાઓ હાબીલ અને કાબીલ હતા, અને તેમનો પ્રસંગ એવું છે કે હજરત આદમ (અ.સ.) હાબીલને તેની પરહેળગારી તથા યોગ્યતાને કારણે ઈસ્મે આજમ દેખાડીને તેને પોતાનો વસી એટસે કે વારસદારે બનાવવા ઈચ્છા હતા. આ સાંભળીને કાબીલના દીલમાં ઈર્ષા અને હસદની આગ ભડકી ઉઠી અને પોતાના પિતા સામે અવિનથી એટસે કે એઝાટલ થઈને કહેવા લાગ્યો કે વારસદારીનો મારો હક છે. હજરત આદમ (અ.સ.)મે એ વાતને ટાળવા માટે કહી રીતું કે તમો બન્ને ખુદાની બારગાહમાં પોતપોતાની કુરખાનીઓ રજુ કરો. જેની કુરખાનીનો સ્વીકાર થશે તે જ આ વારસનો હક્કાર ગણાશે. આથી હાબીલે એક ઘટું લઈ જઈને પર્વત ઉપર રાખ્યું અને કાબીલે જેતરમાંથી થોડું અનાજના દૂડા લઈને રાખ્યા, તે પછી રિવાજ પ્રમાણે આકાશમાંથી આગનો એક ભઙ્ગો ઉત્તર્યો અને હાબીલની રજૂ કરેલી વસ્તુ (કુરખાની) ને ખાઈ ગયો જ્યારે કે કાબીલની રજૂ કરેલી વસ્તુ જેમની તેમ રહી ગઈ. આ જોઈને કાબીલને વધુ શંકા અને ઈર્ષા ઉપજુ અને તેણે હાબીલની હત્યા કરી નાખી. અહી કષણ કુરખાનીની જ હિકમતનો હેતુ છે માટે આપણો આ પ્રસંગની ઊડાણ ચર્ચામાં નથી પડતા.

કુરખાનીનો સૌથી મહાન અને બોધ ગ્રહણ કરવા લાયક નમૂનો હજરત ઈબ્રાહીમ અને હજરત ઈસમાઇલ (અ.સ.)ની મહાન હસ્તી સાથે સંબંધ ધરાવે છે જેનો સારાંશ અને એક ટુક્રો ઉદ્દેખ કુરખાનની સુરહ સાક્ષિત (૩૭)ની આયત ૧૦૧થી ૧૦૭માં મૌજૂદ છે, આથી હજરત ઈબ્રાહીમ (અ.સ.)ના આ દાખલાદુર્ઘી કર્ય વિષે અચે

અમુક છિકમતનો ખૂલાસો કરવામાં આવે છે.

પહેલી છિકમત : કેમકે હજરત ઈબ્રાહિમ (અ.સ.)

અદ્ધાહતઆલાના ખલીલ એટસે કે મિત્ર હતાં તેથી તેમના અતીશય વહાતા ફરજિંદ હજરત ઈસમાઈલની કુરબાનીના દેષ્ટાંતરી ખુદાતઆલાએ લોકો ઉપર એ સ્પષ્ટ કર્યું કે જે માનવંત લોકોનો ખુદાની સાથે સાચો પ્રેમ અને હીકી મિત્રતા હોય છે, તેઓ ખુદાની ઈચ્છા મુજબ દરેક મોટામાં મોટી કુરબાની દેવામાં પાગ જ્વારેય પાછી પાની નથી કરતા.

દીનું છિકમત : કેમકે હજરત ઈબ્રાહિમ (અ.સ.) ન ઇન્દ્રજિત

પોતાના સમયના એક શાન અને મરતબાવાળા - પયગમ્બરજ હતાં
પાગ તેની સાથે સાથે તેઓ એક અતી શાનદાર ઈમામ પાગ હતાં,
માટે ખુદાનો હેતુ એ હતો કે સમગ્ર માનવજ્ઞાતિનું એ સત્ય તરફ ધ્યાન
દેરવખામાં આવે કે પયગમ્બર અને ઈમામની પવિત્ર હસ્તીમાં એ ગૂગ
પાગ હોય છે કે જો ખુદાના તરફથી આજ્ઞા થાય તો તેઓ જરા પાગ
ખચુકયા વગર જાનની કુરબાની પાગ દઈ શકે છે.

ત્રીજું છિકમત : કુરસાનની સુર્ખ તૌબા (૮)-ની અધ્યાત

૧૧૧માં છે કે અદ્ધાહે (જગતના પાલનહારે) અંબીયા, ઔલીયા તથા દરેક સમયના મોમીનોથી તેમના પ્રાણ તથા માલ એ વાતના બદલામાં ખરીદી લીધાં છે કે તેમને જનત મળશે અને હજરત ઈબ્રાહિમ ખલીલુદ્ઘાહ (અ.સ.)એ પોતાના પ્રાણધ્યારા પૂત્રની કુરબાનીનો નિશ્ચય અને નિર્ધાર કરીને આં સત્યનો અમલી નમૂનો - (અમલી સહભિતી) રજૂ કરી દીધી કે યોક્કસપાગે મોમીનોના પ્રાણ હો કે માલ, સર્વે કાંઈ અદ્ધાહતઆલાએ ખરીદિલું છે.

શોથી છિકમત : જેમકે આગળ વર્ણવામાં આવ્યું છે કે

• લોકોના માટે ખુદાની એક સાઝ-સ્પષ્ટ હીદાયત એ પણ છે કે તે શાનોશૈકૃતવાળા પયગમ્બરોના સદ્યારિયથી દાખલા બેસાડીને દેખ મનગમતા અમલને જાહેરમાં લાવે છે, જે મુજબ હઝરત ઈશ્વારીમ (અ.સ.)ના હૃદયમાં જગતના પરખરદીગારની મહોભબત સિવાય ક્રેચ પણ વસ્તુની મહોભબત જ નહોંતી કારણ કે તેવાં પોતાના વખતના ખુદાના આર્થિક અને એક જ ખુદાને માનનાર મહાન માનવી હના પણ - ધીમે ધીમે એવી સ્થિતિ ઊભી થઈ, એવી શક્યતાઓ પેદા થઈ કે ખુદાની મહોભબતની સાથે સાથે પોતાના પૂર્ત હઝરત ઈસમાઈલનોં પ્રેમ પણ હોય, માટે ખુદાના તરફથી આજા આપવામાં આવી કે ખલીલુલાહની સામેણી તે માધ્યમ - તે વસ્તુ જ હટાવી દેવામાં આવે કે જેના લીધે તેવાના દીલમાં સિવાય ખુદાના અન્ય ક્રેચના તરફ પ્રેમ પેદા થતો હતો કે જેથી, તેમ કરવાથી લોકોને બોધ મળે કે મોખીન બંદાના દીલમાં જેટલી દુનિયાની મહોભબત વધી જાય છે તેટલી ખુદાની મહોભબતંમાં ઓછાપ પેદાં થાય છે.

પાંચમી છિકમત : હઝરત ઈશ્વારીમ (અ.સ.), હઝરત મોહમ્મદ પયગમ્બર (સ.અ.સ.)ના પરદાદા (પૂર્વજ) તથા ઈસ્લામ મજહબના પ્રથમ સ્થાપકની હેસીયત ધરાવતા હના માટે ખુદાના નિયમમાં એ એક જરૂરી કાર્ય હતું કે દુનિયામાં ક્યામત આવવા સુધી પેદા થતાર મુસલમાનોને માટે તેવાં કુરબાનીની એક બેનમૂન રીત છોડી જાય કે જેથી તેના પ્રકારશમાં ઈસ્લામ દીનને માનનારા પોતાની અંદર મોટામાં મોટી કુરબાની રજૂ કરવાની ધગશ (લાગ્યારી) જન્માવી શકે.

છુદી હિક્મત : હજરત ઈસ્માઈલ (અ.સ.)ને સઘળા મુસ્તીમો અભીઉલ્હાહના લક્ષ્યથી ચાદ કરે છે, જો કે તેવાગ આ પ્રસંગમાં જુબેહ (અટલે કે ગળા ઉપર ધૂરી ચલાવીને કુરબાન કરી નાખવું તે) નહોતા થયા પરંતુ તેમણે ખુદાની આજ્ઞા ઉપર અમલ કરવા માટે જાન અને દીલથી જે મક્કમન : અને ધીરજનું ઉદાહરણ પૂરું પાડ્યું અને જે શાનથી ખુદાની ખુશનુદી પ્રાપ્ત કરી. તેના પરિણામ રૂપે આ લક્ષ તેવાગના યશ અને ગૌરવને યોગ્ય છે અને આ ને સત્યની એક સચોટ દલીલ છે કે અમુક હીકી મોમીનો મર્યાદ નથી પાગ જીવંત છે પરંતુ તેઓ ખરેખર શહીદ કરેવાય છે કારણ કે તેઓમાં ફરમાંબરદારીના તજ ગૂંગો અને ધગશ મૌજૂદ છે કે જે શહીદિમાં હોતા હોય છે.

સાતમી હિક્મત : જ્યારે મહાન પિતા પૂર્વે આ આવિનાશી - અમર કુરબાનીના માટે દેશ પ્રકારે કબુલાત જાહેર કરી તો ખુદા તાઓલાએ પોતાની રહેમત વડે તેઓની જાનની કુરબાની માઝ કરી દીધી અને તેના બદલામાં માલની કુરબાનીનો તદ્દન એજ રીતે અતીશય મહાનતા અને ઊચ્ચતાની સાથે સ્વીકાર કર્યો. આ ઈશારો એ તરફ છે કે જે ખુદા ઈંદ્ર તો પોતાની હિક્મત થકી હીકી મોમીનની માલની કુરબાનીનો પાગ એ જ સવાબ અને દરજજો દઈ શકે છે કે જે તેના જાનની કુરબાનીના બદલામાં દેવો જોઈએ.

આઠમી હિક્મત : કેમકે કુરબાનીનો અર્થ છે ખુદાની નજીદીકીનો વસીલો અથવા ખુદાની નજીક થવા માટેનું સાધન અને આ અર્થમાં સૌથી મહાન કુરબાની તે છે કે જે ફક્ત એક જ વ્યક્તિ અથવા અમુક વ્યક્તિઓના માટે મર્યાદિત નથી પરંતુ સઘળા મનુષ્યોના માટે ખુદાની

નજીડીકીનું સાધન થઈ શકે અને હજરત ઈસ્માઈલ જબીઉલ્વાહની મહાનતમ કુરબાની એ છે કે તેવાગુના પવિત્ર વંશમાંથી ઈમામો, હીદાયત કરનારાઓનો ક્રમ (એક પરંપરા) ચાલુ રહ્યો અને આગળ ચાલતાં આજ પવિત્ર વંશથી હજરત મોહંમદ (સ.અ.સ.) • છેલ્ખાં નબીનું પવિત્ર જહેરી સ્વરૂપ સામે આવ્યું, અને તેવાગુના નામદાર (સ.અ.સ.)ના પદી હુમેશના માટે આવે મોહંમદ અને ઔલાદે અલીના પવિત્ર ઈમામો (અ.સ.) થતાં રહ્યા.

હવે એ સ્પષ્ટ છે કે આ સઘળા માનવત (ઈમામો)ની પાક જિંદગીઓની જે કુરબાનીથી ઈસ્લામી દુનિયાના અસંખ્ય લોકોને સીધા રસ્તાની હીદાયત અને ખુદાની નજીડીકી પ્રાપ્ત થઈ છે તે ખરી રીતે હજરત ઈસ્માઈલ (અ.સ.)ની જાતની કુરબાનીથી ધારી બધી વધીને છે અને એણા જાગ્રાતું જોઈએ કે “એ કુરીનાહુ બીજીહીન અગ્રીમ” (૩૭/૧૦૭) (અર્થ : અને અમોએ એક મહાન બલીદાન (તેના બદલામાં) નક્કી કરી તેને (ઈસ્માઈલને) મુક્તિ આપી)ની એક તાવીલ આ છે.

Knowledge for a united humanity

નવમી હિન્મત : એ જાગ્રાતું કે કુરબાની એટલે કે બલીદાન એક એવો બહોળા અર્થવાળો શબ્દ છે કે જેના અર્થમાં સઘળી નેકીઓ દાખલ થઈ આવે છે અને કોઈ પાગ નેક કામ તેનાથી બહાર એટલે કે દૂર નથી રહી શક્યું કારણ કે કુરબાની એ ખુદાની નજીડીકીનું સાધન છે અને પ્રત્યેક નેકી પોતે જ એ વસીલો છે. આ ઉપરથી એ જાગ્રાત છે કે કુરબાનીઓ ધારા પ્રકારની છે પાગ કોઈને એની જાગ નથી કે હાલ એટલે કે અત્યારે હીન અને મજાહુલ તેનાથી ક્યા પ્રકારની

કુરબાનીની માગણી કરી રહો છે. એ તો સાહેબે અમૃ એટલે કે હુકમના માત્રકો જ યોગ્ય રીતે ખબર છે માટે સાહેબે અમૃની તાબેદારી જરૂરી અને ફરજિયાત છે.

દસમી છિકમત : ઉપર જાગાવેલી કુરબાનીના વિષે કુરાયાનમાં (39/૧૦૬) ફરજાવેલું છે કે આ એક ખુલ્લી કસોટી હતી અર્થાત આ કુરબાનીથી અધાર તથાલાનો હેતુ હજસત ઈબાહીમ (અ.સ.) અને હજસત ઈસમાઈલ (અ.સ.)ની પરીક્ષા લેવાનો હતો, તેમની કસોટી કરવાનો હેતુ હતો અને આ કસોટી, આ પરીક્ષાને માટે જે શબ્દ વપરાશમાં છે તે છે ‘બલા’. જો કે સામાન્ય સમજ પ્રમાણે ‘બલા’ શબ્દને ધ્યાણ ખરાબ સમજવામાં આવે છે પણ અહીં એ સત્ય સ્પષ્ટ અને સાઝ છે કે પ્રત્યેક બુલા એક પરીક્ષા છે (એક કસોટી છે) અને પ્રત્યેક કસોટી, કુરબાની તથા ખુદાની નજીદીકીનું સાધન છે.

અગ્યારમી છિકમત : એ જાગાવા મળ્યું કે દરેક બલીદાન (દરેક કુરબાની) પછી તે નાનું હેય કે મોટું પોતાની હેસીયતથી એક કસોટીના સ્વરૂપમાં સામે આવે છે અને કસોટી તથા બલાનું બીજું નામ છે મુસીબત અને સ્પષ્ટ છે કે પ્રત્યેક મુસીબત પોતે જ પરિક્ષા અને કસોટી છે અને દરેક પરિક્ષા, સફળતાના સ્વરૂપમાં એક બલીદાન અને ખુદાની નજીદીકીનું સાધન છે. પરિક્ષા અને કસોટી વિષે આ ત્રણ આયતો રજૂ કરું દ્વાંનું :

“વ લંબલુન્નકુમ બ શૈચ્ચીન...થી લઈને....હુમુલ મુહનદ્દુ”.
(૨/૧૫૫-૧૫૭)

અર્થ :- અને અમે તમારા થોડાક ભયથી અને થોડીક ભૂખથી તથા માલ તથા પ્રાગું અને ફળો (ફરજિયાત)ના નુકસાનથી

ଶ୍ରୀମଦ୍ଭଗବତକାଣିଙ୍କ ପାଇଁ ହିଁ (ଅଛୁଟ ତିଥି) ମୁଖ ଜ୍ଵଳିଲେ କିନ୍ତୁକିମ୍ବୁ
 ମହିମା ବୈଷ୍ଣବ. ଏ ଓ ତାଙ୍କ ପାଇଁ ମୁଖୀୟ ଦେଖିଲେ କିମ୍ବୁ
 କିମ୍ବୁପାଇଁ କିମ୍ବୁକାଣି ଅର୍ଥମ ଯିମନ୍ତରେ ଏହା ମୁଖ ମୁଖୀୟ
 କିମ୍ବୁପାଇଁ କିମ୍ବୁକାଣି ଅର୍ଥମ ଯିମନ୍ତରେ ଏହା ମୁଖ ମୁଖୀୟ
 "ଏ କିମ୍ବୁପାଇଁ କିମ୍ବୁକାଣି ଅର୍ଥମ ଯିମନ୍ତରେ ଏହା ମୁଖ କିମ୍ବୁକାଣି ମୁଖ
 ଏ ରୂପ ଅଭିନ୍ନ କିମ୍ବୁକାଣି ଏହା କିମ୍ବୁକାଣି ମୁଖ ମୁଖୀୟ କିମ୍ବୁକାଣି
 କିମ୍ବୁକାଣି ଏହା କିମ୍ବୁକାଣି ଏହା କିମ୍ବୁକାଣି ଏହା ରୂପ
 ଏହା କିମ୍ବୁକାଣି ଯିମନ୍ତରେ ଏହା କିମ୍ବୁକାଣି ଏହା ମୁଖ ଏହା କିମ୍ବୁକାଣି
 ଏହା କିମ୍ବୁକାଣି - .ଏ ଏହା କିମ୍ବୁକାଣି ଏହା କିମ୍ବୁକାଣି

Institute for Spiritual Wisdom and Luminous Science

Knowledge for a united humanity

ગ્રાણ સવાલ - ભારતથી

સવાલ ૧ : શું સુલુલ્લાહ (સ.અ.સ.) ઉપર જીજાઈલના મારક્ષત વહી ઉતસ્તી હતી કે તેવાળ નામદાર (સ.અ.સ.)ની પોતાની કોઈ રૂહાની શક્તિ એવી હતી ?

સવાલ ૨ : કુરાનમાં હજાસ અલી (અ.સ.)ના વિષે કઈ કહી આપતો ઉત્તરી છે ? અને ક્યાં ક્યાં ઉત્તરી છે ?

સવાલ ૩ : ખુદાવંદાલાએ આ દુનિયાને શા માટે પેદા કરી ? જો આપણે એમ ક્રીએ છીએ કે પોતાની જીતને ઓળખાવવાને માટે દુનિયાને પેદા કરી છે, તો પછી શું આપણી રૂહે આરંભના દ્વિસથી (રોજ અજલથી) ખુદાની ઓળખાણ નહેતી ધરાવતી ? જ્યારે કે ખુદાવંદાલાએ ફરમાવી દીધું કે “અલસ્તુ બિ ર્ઝ્ઝી કુમ” તો આપણી રૂહેએ જ્યાબમાં કહું હતું કે “કાલુ બલા”. (આ વિષયમાં ખુલાસો કરો).

Knowledge for a united humanity

જવાબ

૧. જી હા ! પયગમ્બર સાહેબ (સ.અ.વ.) ઉપર જીજાઈલ ફરીશનાના મારક્ષત વહી ઉતસ્તી હતી કેમકે એ કુરાનનો જ ફેસલો છે. કુરાનમાં તમો ૨/૮૭, ૧૬/૧૦૨, ૨૬/૧૮૩ વિગેર જોઈ જુઓ.

પરંતુ તેની સાથે સાથે એ પાળ જાગવું જરૂરી છે કે ફરીશાઓ

સંપૂર્ગ મનુષ્ય એટલે. કે સર્વજ્ઞાનસંપત્તિ માનવી (ઇમામ તથા પયગમ્બર)ની રૂહાની શક્તિથી બહાર નથી - (ઉપર નથી). અર્થાત પયગમ્બર તથા ઇમામની અસંખ્ય રૂહાની શક્તિઓ જ ફરીશતાની હેસીયતથી છે જે મુજબ તેમની અક્ષણ - જ્ઞાનની શક્તિ એ જ્ઞાનાઈસ ફીરશનો છે. તેમની સમજવાની શક્તિ મેકાઈસ છે. બોલવાની શક્તિ (અવાજની શક્તિ) અસરાઈસ અને વિચાર શક્તિ અજરાઈસ છે અને તે સિવાય એક સત્ય એ પાણ છે કે. સર્વ-સંપૂર્ગ માનવીની આ શક્તિઓ (કુ જે ફરીશતાઓ છે) જુદા જુદા મનુષ્યોના સ્વરૂપમાં મળતા આવતા હોય છે કારણ કે ફરીશતાઓના પોતાના સ્વરૂપ નથી હોતા. તો આજ કારણ છે કે નામદાર પયગમ્બર સાહેબ (સ.અ.સ.)ની જ્ઞાનાઈસની શક્તિ (એટલે કે જ્ઞાન શક્તિ) હજરત સલમાન ફારસીના સ્વરૂપમાં મળતાપણું ધરાવીને કર્ય કરતી હતી અને આ સત્યના કેટલાંય પાસા થયા જે એ છે કે જ્ઞાનાઈસ (અ.સ.) એક મહાન ફરીશતા છે અને એ ખર્દું છે. વળી એ પાણ ખર્દું છે કે સર્વ-સંપૂર્ગ માનવીની જ્ઞાન શક્તિ જ્ઞાનાઈસ છે અને એ પાણ સાચું છે કે એક ઊર્ધ્વ દરજજાના મોમીનની રૂહને જ્ઞાનાઈસનો દરજજો દેવામાં આવે છે. જેમકે સલમાન ફારસીનો દાખલો છે કે જે ઉપર જણાવ્યું છે.

(2) કુરખાનમાં હજરત અમીરીસ મોમનીન અલી (અ.સ.)ની પવિત્ર શાનમાં જેટલી આયતો ઉત્તરી છે તેની પદ્જનીસરની ગાગન્ત્રી કરવી અને તે ક્યાં ક્યાં ઉત્તરી હતી તે જગ્ઘાવવું મુશ્કેલ છે અને જો એ કામ કરવામાં આવે તો એ વિષય ઉપર એક મહાન ગ્રંથ જેવું પુસ્તક લખવાની અને ધાર્યું બધું સંશોધન કરવાની જરૂરત રહેશે પરંતુ અમારી એવી કોઈ યોજના નથી માટે આ કામના માટે તે પુસ્તકોના

તરફ રજુ થવું જોઈએ કે જે હજસ્ત અલી (અ.સ.)ની પ્રવીણતા અને જ્યાતી વર્ગવતા પુસ્તકોની હેસીયત ધરાવે છે દાખલા તરીકે “ક્રોકબે દુર્ભિ”, “અર્જહુલ મુનાલીબ”, વિગેર અને સૌથી પ્રથમ શીયા ખુલાસાઓ સામે રાખવા જરૂરી છે. આ સિવાય આપણે આ લાંબા કાયને ઢ્ણામાં ઢ્ણું પાગુ કરી શકીએ છીએ, જે પોતે મૌલા અલી (અ.સ.)ને ઇરમાવેલું છે કે :

નજલલ કુરાખાનું અદબારાન ઈ રૂભઉ ક્રીઝ વ રૂભઉ ક્રી અદૃષ્ટીના વ રૂભઉ સીયર્ડંબ્ય અમસાલુંબ્ય વ રૂભઉ ક્રાઈઝંબ્ય અહેકામુન વ લના કરાઈભુલ કુરાખાન.

કુરાને મજૂદ ચાર ભાગમાં ઉત્ત્યુ છે, અને તેનો ચોથો ભાગ (એટલે કે પા ભાગ) અમારી શાનમાં છે, ચોથો ભાગ અમારા શત્રુઓના વિષ્યંમાં છે અન્ય ચોથા ભાગમાં પ્રસંગો અને ઉદાહરણો છે અને બાકીના ચોથા ભાગમાં ઇઝો અને આજાઓ છે અને કુરાને મજૂદની મોટી આયતો અમારી શાનમાં છે (પુસ્તક અર્જહુલ મુનાલીબ – પાના નંબર ૫૮).

હું આ કલામે મૌલાનો ખુલાસો કરતાં દાવો કરું છું કે કુરાનનો જે ચોથો ભાગ પ્રસિદ્ધ રીતે મૌલા અલી (અ.સ.)ની શાનમાં છે તે તો છે જે, તે સિવાય બાકી પોગા ભાગમાં પાગ હજસ્ત અમીરુલ મોમનીનના વખાગ અને ગ્રૂગોનું વર્ગન છે. તે એ રીતે છે કે પયગભરે બરંજનું ઇરમાન હતું કે “અય અક્ષાહ મિત્ર રાખજે તેને કે જે અલીને મિત્ર રાજે અને શત્રુ ગાગજે તેને કે જે અલીને શત્રુ ગણે છે (અક્ષાહમ્ વ લીમન વ લા છુ વ આદીમન આદાહ). આ પરથી એ અર્થ સ્પષ્ટ થઈ જાય છે કે પવિત્ર કુરાનના જે ચોથા ભાગમાં ખુદા

અને રસૂલ (સ.અ.સ.)ના જે શત્રુનો જોવો ઉલ્લેખ આવેલ છે તે અસલમાં હજરત અલી (અ.સ.) તથા. હજરત અલીના વંશમાંથી જે ઈમામો છે તેના શત્રુઓનો ઉલ્લેખ છે પછી જ્યાં એવા શત્રુઓની ઝાટકણી કાઢવામાં આવી છે. (વખોડવામાં આવ્યા છે) ત્યાં તાવીલ રૂપે હજરત અમીરૂલ મોમનીનના વખાગું કરેલાં છે.

કુરાનના જે અન્ય ચોથા ભાગમાં પ્રસંગો અને ઉદાહરણોનું વાર્ણિન છે તે આઇકન્ટરી અને સીધી રીતે અંબીયા (અ.સ.)ના વિષે છે અને હજરત પયગમ્બર સાહેબ (સ.અ.સ.)નું ફરમાન છે કે :

“યા અલી કુન્ત મખલ અંબીયાઈસીરિંવ્ય મર્દ જહરન.”

અય અલી તમો સધળા પયગમ્બરોની સાથે ગુપ્ત રીતે મૌજૂદ હના અને મારી સાથે તમો જહેર છે. આનું પરિણામ એ આવ્યું કે હજરત અલી (અ.સ.) ન ફક્ત સધળા અંબીયાઓની સાથે છે બલ્કે તેમના સંબંધે સધળા પ્રસંગોમાં પણ તેવાગું ભજેલાં છે.

હવે અમો કુરાનમાં આવેલાં ઉદાહરણોના માટે કંઈક કહીએ છીએ તે એ કે કુરાને મજૂદના અમુક ઉદાહરણો વાસ્તવીક પાસુધરાવીને અને અમુક નકારાત્મક પાસા વડે સર્યાઈની છિકમતના સધળા દરજજાઓની છિકમતનું વાર્ણિન કરે છે, જે માટે ખુદાનું ફરમાન છે:

“બલ નક્કીનું બિલ હક્કી અલલ બાતીલ વયદ મગુહુ ઈ ઈઝા હુવ આહીકુન” બલ્કે અમો તો સત્યને અસત્ય ઉપર ઝેકી મારીએ છીએ કે જેથી તે (સત્ય) નેનું (અસત્યનું) માથું ભાંગી નાખે છે (૨૧/૧૮).

આ ફરમાનથી ન ફક્ત એ જ માલુમ પડે છે કે કુરાનના

ખાસ ખાસ સત્યો ઉદાહરણોમાં વર્ગવિલાં છે બલ્કે સાથે સાથે એ પાગું સ્પષ્ટ થયું જે સત્ય અને અસત્યનો છેવટનો નિર્ણય પાગ એ જ ઉદાહરણોમાં મૌજૂદ છે અને એ જ કારણ છે કે જે હજસ્ત રસૂલ (સ.અ.સ.)મે ફરમાવ્યું છે કે “અલ હક્કુ મખ અલી” એટલે કે હક - સત્ય અલીની જ સાથે છે. જ્યારે એ જગ્યાયું કે સત્ય અને હકીકત અલીની જ સાથે છે અને સત્યને કુરાઓના ઉદાહરણોમાં વર્ગવિલાં આવેલ છે તો સ્પષ્ટ છે કે કુરાઓનો તે ભાગ પાગ હજસ્ત અલી (અ.સ.)ની જ શાનમાં છે કે જેમાં સત્યતાની હકીકતોના દરજાઓના ઉદાહરણો છે.

હવે રહી કુરાઓના છેવટના, ચોથા ભાગની વાત, કે જેમાં ફરજો અને આજ્ઞાઓનો ઉદ્દેખ છે. તે વિષે એ જગ્યાવવાનું કે ફરજો અને આજ્ઞાઓ ઉપર અમલ કરવો - તેને પૂર્ણ કરવી ખુદાની તાબેદારી કહેવાય છે પણ ખુદાની એ તાબેદારી રસૂલ (સ.અ.સ.) તથા ઉલ્લિલ અધ્ર (એટલે કે સાચા ઈમામ)ના માર્કનું કરવામાં આવે છે કારણ કે એ જ તે માનવંત લોકો છે કે જેઓ ખુદા તરફથી ફરમાવવામાં આવેલ ફરજો અને આજ્ઞાઓના ખુલાસાઓ સમય એટલે કે જમાના અને સ્થળ એટલે કે જ્યા અનુસાર લોકોને બતાવે છે. જેમકે કુરાનમાં ફરમાવેલ છે કે :

“અય ઈમાનવાળાઓ ! તમો અલ્હાહની ફરમાં બરદારી કરો અને રસૂલની ફરમાંબરદારી કરો અને ઉલ્લિલ અધ્રની ફરમાંબરદારી કરો કે જે તમારામાંથી છે.”

જ્યારે એ જાગુમાં આવ્યું કે કુરાને મજૂદના તે ભાગમાં પાગ મૌલાના અલી (અ.સ.)નો સુંદર ઉદ્દેખ મૌજૂદ છે કે જે ભાગમાં

કુરાજો અને આજ્ઞાઓનો ઉદ્દેશ છે તો હવે અમો જગાવી શકીએ છીએ કે કુરાનની ક્રોઈ આયત એવી નથી કે જેમાં ક્રોઈને ક્રોઈ પ્રકારે હજરત અલી (અ.સ.) અર્થાત ઈમામતના નૂરનો ઉદ્દેશ ન કરવામાં આવ્યો હોય. આ તમારા બીજા સવાલનો સંપૂર્ણ જવાબ છે.

(૩) ચોક્કસપણે આ દુનિયા એટલા માટે પૈદા કરવામાં આવી છે કે અહીં આવીને રૂહેને ખુદાવંદનાલાની અમલી ઓળખાણ પ્રાપ્ત થાય અને જો “અલસ્તુ”ના પ્રસંગોની ઓળખાણ કાયમ માટે (હંમેશાને માટે) પૂર્તી અને રહેનારી હોતે તો દરેક મનુષ્ય જન્મે જ ખુદાના આરીક એટલે કે ખુદાને ઓળખનારા હોત. સ્પષ્ટ છે કે આપણી તે માર્ખન્ત (તે ઓળખાણ) જેનો ઉદ્દેશ કુરાનની આયત (૭/૧૭૨)માં છે, તે આગુ જગત (અર્થાત રૂહેના આગુઓની દુનિયા)માં હતી અને તેથી પહેલાં એક ઊડાણ સમજવાળી માર્ખન્ત પણ પ્રાપ્ત થઈ હતી પરંતુ તે ઓળખાણોને ફરીથી તાજ કરવાને માટે રૂહેને દુનિયામાં આવવાની જરૂરેત હતી, માટે સધળા મનુષ્યો જગતમાં (દુનિયામાં) આવી ગયા અને કસોટી તથા પરીક્ષાના મેદાનમાં ઉત્તરી પડ્યા અને તેમાં ક્ષક્ષ થોડાંક સફળ થઈ ગયા બાકીના બધા નિષ્ઠળ થયા.

આ સવાલનો જવાબ બીજી રીતે પણ આપી શકાય છે, અને તે એ કે ર્યના કરવાનો કમ હંમેશાથી છે અને કાયમ ચાલતો રહેશે અને તેનો હેતુ એક નહીં ઘણા હેતુઓ છે જે એકથી એક ચઢીયાતા છે અને અહીં એકદરે જે હેતુ છે તે રૂહેની તેજસ્વીતાઓ – કાંતીઓ તથા રૂહનું જાહેર થવું અને તે દરેક બાબતોને માટે અમારી રૂહ મોહતાજ છે અને ખુદા હરગીજ મોહતાજ નથી.

અલવાઅજ અલ્ખામા નસીરુદ્દીન નસીર હુંગાઈની સેવામાં

આવકાર પ્રવચન

ધી પાક ઈસમાઈલીયા હુંઝા (શનાકી) મલ્ટી પરપાજ
ક્રો-ઓપરેટીવ સોસાયટી લીમિટેડના તરફથી

માનવંત સાહેબ ! હુંઝા અને ગીલ્ગીટ રાજ્યની ઈસમાઈલી
જમાતના માટે પાકિસ્તાનની ઈસમાઈલીયા એસોસીએશનની શાખાની
સ્થાપના અને તે શાખાના ઈન્ચાર્જ તરફિક આપ માનવંત સાહેબની
નિયુક્તિના મુખ્યારક અને ઐતિહાસિક પ્રસંગે શનાકી ઈસમાઈલી જમાતની
દીની અને દુન્યવી તથા જાહેરી અને બાતીની ખુશીઓનો ક્રેદ પાર
નથી. આ પ્રસંગે સર્વ પ્રથમ મૌલાયે કાયનાતના લાખ લાખ શુભર
કે તેણે પોતાની અગાણિત રહેમતો વડે આપના જેવા જ્ઞાની છિકમણ,
મારફત જેવી મહાન અને એકદર ખૂબીવાળા તથા સ્પષ્ટતા અને
સર્ચાઈ નમતા અને પરહેઝગારી જેવા સદાચાર અને સુંદર ગૂંગો
ધરાવનારા દીની બુઝુંગને સત્કારવા અને આવકાસની નેક તૌકીક
અર્પણ કરી.

બીજું એ કે અમો આપ માનવંતના પણ ધારું જ આભારી
છીએ કે. આપ માનવંત સાહેબ સમયની અધિક અને અતીશય કામની
રોકાણ છું અમારા નાચીજ આમંત્રણનો સ્વીકાર કર્યો.

માનવંત સાહેબ ! આ નાનકડો સમારંભ ન તો કોઈ ઓળખાગુણ કરાવવાના રિવાજ ખાતર યોજાગુણો છે અને ન. તો આપ સાહેબને તેની જરૂરત છે, બલ્કે આ સમારંભનો હેતુ એ છે કે આ ઐતિહાસિક પ્રસંગ ઉપર, કે જે ગીલ્ગીટ, પુનીયાલ, ઈશ્કોમન, યાસીન, ક્રોઝગુજર બલ્કે સમસ્ત મધ્ય એશિયાની ઈસમાઈલી જમાતની રૂહાની અને જ્ઞાનની પ્રગતીમાં એક પાયા રૂપી હેસીયત ધરાવે છે, આપ સાહેબની શુદ્ધ, નિસ્વાર્થ અને ઐતિહાસિક સેવાઓના સ્વીકારને માટે દીલથી વિશ્વાસ, પ્રેમ જાહેર કરવો અને સૌથી પ્રથમ મુખાર્કબાદ દેવી કે આપ સાહેબે લગભગ પા (૧/૪) સદીમાં અસંખ્ય મુસીબતો છાં હૈયાત અને હાજર ઈમામની દાવતે હક્કના પ્રચાર તથા ઈસમાઈલી જમાતને રૂહાની પ્રગતી અને મુક્તિ તથા દુન્યવી આબાદી અને પ્રગતીના માટે જીવનના દેશે ક્ષેત્રે સેવા કરી છે.

આપ માનવંતે સાચા મજહબના પ્રચારના માટે શું શું નથી કર્યું. કેદ અને બંધનની તકલીફિથી લઈને મિત્રો અને પારકા લોકોની શરિયાદો અને ટીકાઓ તથા બીજી મુશ્કેલીઓને ધીરજ અને સબર સાથે તથા હસતા મોઢે સહન કર્યા અને સત્ય તો એ છે કે આજના દિવસે અમારા તે મહાન અને બહાદુર દાઈઓની જીદગી સામે આવે છે કે જેમારે વખતના ઈમામની ખુશી તથા દીન અને ઈમાનના રક્ષાગુણ અને હિક્મત તથા ફીલ્દુફીલીની પ્રગતીના માટે પોતાની સર્વ વસ્તુઓનું બલીદાન આપી દીધું અને છેવટે ઈમામેજમાનની દુઆ અને બરકતો અને પોતાના પ્રયત્નો વડે ઈદમ અને હિક્મતના મેદાન અને દીન અને ઈમાનના રસ્તા ઉપર જીવંત નિશાનીઓ છોડી ગયા છે કે જે આવનાર સમય સુધી ભૂસાવી નથી શકવાના.

માનવંત સાહેબ ! આપની માનનીય હસ્તી તેજ મહાન દાઈઓ ની જીવંત કટ્ટપના છે જેનાથી જ્ઞાન અને હિકમત તથા તાવીલ અને સર્ચ્યાઈનો પ્રકાશ પ્રજ્વલિત થયો છે. ઈસમાઈલી દાઈઓની એ અનોખી બાબત રહી છે કે તેઓ ઈસ્લામ જેવા સંપૂર્ણ, જીવંત, ગતિમાન, કુદરતી અને પૂરા જગતના દીન-મજાહબની હિકમત અને શિખામાણોના મારશ્ટ પોતાના સમયની પ્રચલિત શીલ્સુદ્ધીવાળી અને વિજ્ઞાનિક ભાષા અને સંક્રિતોમાં પ્રચાર કરે કે જેથી તે પ્રચાર - તે દાવતને, કબૂલ કરનારાઓ ઈસ્લામની સર્ચ્યાઈ જ્ઞાન અને હિકમતના પ્રકાશમાં અક્ષલ અને રૂહના ઊડાગથી કબૂલ કરે અને તેઓને જ્ઞાન અને હિકમતના પ્રકાશમાં દુન્યાવી અલ્પતા અને રૂહાનીયતની મહાનતા તથા મોટાઈનું ભાન થઈ જાય કે જે જગતના સધળા મજાહબોની ડેણવાળીનો ખુલાસો છે.

આ મહાન હેતુને નજર સમક્ષ રાખીને અવલોકન કરવામાં આવે તો આપ માનવંત સાહેબની પ્રચાર સેવા ખૂબ જ કદર કરવા લાયક છે અને તેનું યોગ્ય અવલોકન તેજ વખતે થઈ શકે છે કે તેઓના પ્રભ્યાત પુસ્તકો “સીલસીલાએ નૂરે ઈમામત”, “મીજાનુલ હકાઈક”, “મીઝતાઉલ હીકમત”, “પીર નાસીર ખુશરૂ અને રૂહાનીયત”, “દરખ્ટે તૌબા” વિગેરના સમયસર અને વારંવાર અભ્યાસ કરવામાં આવે.

આ પુસ્તકોમાં આપ સાહેબે ઈમામતના નૂરની અનંતતા, ઈમામતા પાવિત્ર ભેદ, વખતના ઈમામની બાતીની મદદ અને તેના મારશ્ટ રૂહાની પ્રગતિ, ભૌતિક્યા અને રૂહાનીયતનો એકબીજાથી સંબંધ અને ભૌતિક્યા ઉપર રૂહાનીયતની મહાનતાના જે વિષયો ઉપર હિકમત

અને વિજ્ઞાનની ભાષામાં જે ખુલાસાઓ આપ્યા છે તે માટે કોઈ પાગ જ્ઞાની અને અક્ષરવાળો માનવી દાદ દીધા વગર રહી નથી શક્તો.

માનવંત સાહેબ ! આપની જ્ઞાન સાથે સંબંધ રાખનાર મહાનતાની એ સ્થિતિ છે કે આ કાંતીકારી યુગમાં જ્યાં પ્રત્યેક હુન્નરવાળા જ્ઞાનમાં વિદ્યુતકેગી ભૌતિક પ્રગતિના પરિણામે નીતનવી વાતો બહાર આવે છે અને ખાસ કરીને ચંદ્ર ઉપર જવા અને મશીનના માનુષી જેવા કટ્પનામાં ન આવે તેવા પ્રસંગો જાહેરમાં આવે છે જેથી સમગ્ર બ્રહ્માંડ અને મનુષ્યના વિષે ધ્યાન પ્રચલિત સિદ્ધાંતો જેવા કે કેંદ્ર તથા માનવીના સ્થાન વિગેરે ઉલટસુલટ થઈ જવાથી ચિંતન અને મનન કરનારા અને ખાસ કરીને મજહબોના આલીમ - જ્ઞાની લોકો અની ધ્યાણી મુંજવણુમાં પડેલા છે અને જ્યાં જગતની આબાઈનો વધુ પડતો ભાગ ભૌતિક વસ્તુઓની ભરમારથી ગભરાઈને છંદગીના જાહેરી ભાગને જ સધળું સમજવા લાગ્યો છે ત્યાં આપ માનવંત સાહેબ હાજર ઈમામની સર્વત્ર ફેલાયેલ તથા સર્વશક્તિમાન જ્ઞાની મદ્દ થકી છિકમતના ધોડા ઉપર સવાર થઈને ભાષાની દ્ધૂરી તથા કલમની તલવારથી રૂહાનીયતની હરિશ્ચાઈમાં આવનારા ભૌતિકિતાના દેખ હુમલાનું જ્ઞાન અને વિશ્વાસ વડે રક્ખાગુ કરવા હર પળે તૈયાર છો અર્થાત આપ સાહેબ સામે આવનાર દેખ કોયડાઓના વ્યાજબી જવાબ દેવાને માટે તૈયાર છો, ઝીલ્સુઝી હોય કે વિજ્ઞાન અથવા મજહબ. કોઈ પાગ એવો સવાલ નથી કે જેનો કોઈ તુરત ઊંલ આપની પાસે ન હોય, આપ દેખ મુશ્કેલથી મુશ્કેલ કોયડાઓનો જવાબ ખૂબ જ સહદયી રીતે અને સરળતાથી આપો છો. ખાસ કરીને આપ સાહેબ જ્યારે કુરાઓની છિકમત અને રૂહાનીયતના ભેદોના વિષયમાં બોલવા લાગો છો ત્યારે

આપની દલીલોમાં એ સ્થિરતા અને સંતોષ હેનાર સાબિતીની રજીની
હોય છે. જો કોઈ મજહબને ન માનનારો પણ સાંભળે તો જાગે
અજાગે પણ દીન અને રૂહાનીયતની ઉચ્ચતાનો સ્વીકાર કર્યા વગર
નથી રહી શક્યો.

આપની જ્ઞાન બાબતની દલીલોથી ખરેખર અક્ષલ નમી પડે
છે (સ્વીકાર કરી લે છે) અને મોમીનને એ પાકી ખાત્રી થઈ જાય
છે કે નિઃસંશય આ હૈયાત અને હાજર ઈમામની મહદુનું જ કણ છે
કે જેના થકી દેશેક વ્યક્તિ દેશેક મનુષ્ય હજરત ઈસા (અ.સ.) જેવાં
મોજ્જા કરવાની રજી મેળવી શકે છે.

માનવંત સાહેબ ! આપની વાણી અને લખાણ દ્વારા
મળતી કેળવાળીથી પૂર્વથી લઈને પશ્ચિમ સુધી ધારુા બધા વિદ્યાર્થીઓ
ફરયદ્દી મેળવી ચૂક્યા છે. આપ સાહેબે ઈસમાઈલી મજહબની જુદી
જુદી હેસીયતે અને અલગ અલગ સ્વરૂપે સેવા કરી છે અને તેમાંની
એક મહાન સેવા દારૂલ હીકુમતની સ્થાપના છે. આ કાર્ય એવું છે કે તે
તેને ઈસમાઈલી ઈતિહાસમાં સૌનાના અકસ્રે લખાવું જોઈએ કારણ કે
હાલના સમયમાં. આ સંસ્થા મારફત ધારુાં જ ટંકા અરસામાં કોઈ પણ
જાહેરી સાધનો ધરાવ્યા વગર ઈસમાઈલી મજહબ ઉપર લેખિત અને
તેના તરજુમા (અનુવાદ)નાં સ્વરૂપમાં જે અતી ધારુાં પુસ્તકો પ્રગટ
થયા છે તે દેશેક પ્રકારે વખાળને પાત્ર છે અને હાલના સમયની ઊભી
થયેલી જરૂરીયતના હીસાબે તદ્દન વ્યાજબી છે.

માનવંત સાહેબ ! આ ઉપરાંત આપનો તે સમય પણ ધારુાં
જ મહત્વનો રહ્યો છે જેમાં આપ સાહેબે પાકિસ્તાનની ઈસમાઈલીયા

એસોસીએશનના ડેક્રમાં રૂહાનીયત અને તત્વજ્ઞાનના ઈલ્લુષ્ટ્રેશન તથા શિક્ષક તરફિં લેખો અને ભાષણોના સ્વરૂપે ઘણી સેવા આપી છે અને એ જ સમયનું એક સંશોધન કરેલ પુસ્તક “પીર નાસર ખુશરુ” અને “રૂહાનીયત”ના નામથી પ્રગટ થઈ ચૂક્યું છે અને આપની ભાષણો દ્વારા આપાતી ડેળવાણીની એ અસર છે કે આપથી બાતિનના જ્ઞાન વિષે અમુક મુદ્દાઓની ડેળવાણી લીધા પછી અન્યોની દલીલો ગમે નેટલી છિકમત વાળી અને તત્વજ્ઞાન વાળી કેમ ન હોય, તે એક શાળામાં ભાગતા બાળકની દલીલ જેવી લાગે છે, અને એમ કેમ ન લાગે, કારણ કે ઈસમાઈલી દાઈઓની દરેક સમયમાં એ જ જ્ઞાન રહી છે અને એ જ આપણી હીકી મેરાજ છે. અને આ સર્વત્ર ફેલાયેલ અને સૌને મનપસંદ જ્ઞાનનું ખાસ સ્થાન ઈસમાઈલી દાઈઓની પાસે (જેમકે પહેલાં પાગ જગાવેલું છે તેમ) ઈમામે જમાન જ છે, જેમની મદ્દ અને સહાયતા તથા પ્રેમના વગર આ જ્ઞાન પ્રાપ્ત નથી થઈ શક્યું.

માનવંત સાહેબ ! આ સામાન્ય સેવા ઉપરાંત હુંઝાના રાજ્યના ઈતિહાસમાં આપ સાહેબની એક વ્યક્તિગત ખાસ હેસીયત પાગ છે અને તે એ છે કે આપ સાહેબ હુંઝા જેવા પદ્ધતા રાજ્યના નવાઈ પમાડનાર અને અતી જડી પ્રગતી કર્નાર રૂહાની આગેવાનની હેસીયત પાગ ધરાવો છો, જેની શરૂઆત જેમકે આપ સંઘળા જાણો છો તેમ હજરત ઈમામ સુલતાન મુહમ્મદશાહ (અ.સ.)ના આ મુખાએ ઇરમાનથી થઈ છે કે જે સરકાર સાહેબે દિલહી રેડીઓથી ૧૧ માર્ચ ૧૮૪૩ના ઇરમાયેલ કે :

“જમાતે ઈસમાઈલીયા હુંઝા વ બદખ્શાન રા ઈસલામ મીર

સાનમ વ મહેરબાની ખુદ યક્તીન દારીદ કે નૂરે મુહુબ્બત મન મસ્લ આશ્વિતાબ બર જમાતે હુંઅ ખ્વાહુદ રસીદ."

એમાં કોઈ શંકા નથી કે માનવંત સાહેબે ઈમામતના આશ્વિતાબ (સૂર્ય)ના પ્રેમ અને રહેમતના નૂરથી શાયદો મેળવીને એક અતી લાયક હીરા હોવાનું સાબિત કરી દીધું છે, એ માટે કે અહીની રૂહાની અને જ્ઞાનની પ્રગતી કે જે કોઈ પણ ક્રેમ અને દેશની પ્રગતીનું સાચું ધોરણ છે, તેનો આરંભ આપ સાહેબના શબ્દો વડે થયો અને જેને વખતના ઈમામ હજરત મૌલાના શાહ કરીમ અલ હુસૈની (અ.સ.) હાજર ઈમામે ગીનાનનો દરજજો અર્પણ કર્યો છે.

આપ સાહેબે પોતાના એ શબ્દોમાં એક ખુદા વિષેના જ્ઞાન, હજરત રસૂલ (સ.અ.સ.) અને તેમના પવિત્ર વંશના વખાગું તથા ઈસમાઈલી ઝીલ્સુઝી ને સમાવીને અહીના સ્ત્રી-પુરુષ, નાના મોટાં, બાળક અને બુર્જુર્ગમાં એક અનોખી રૂહ કુંકી છે.

આપના એ શબ્દો (ગીતો) ઉદ્દૃ શરસી અને તુર્કી સિવાય સ્થાનિક ભાષા બુસેસ્કીમાં હોવાને લીધે જ્યાં એક તરફ સમજવામાં સરળ છે ત્યાં બીજી તરફ એક રૂહાની જ્ઞાનને પોતામાં સમાવેલાં છે અને તેની અસરનો એ હાલ છે કે ઈમામે જમાનના નૂરના સાચા આશીક તેને સાંભળતાં જ આ મર્યાદિત જગતની સિથનિમાંથી નિકળીને (રૂહાની રીતે) લા-મજનમાં પહોંચી જાય છે. આપ સાહેબની મજલીસો રૂહાનીયતના અમલની સિથનિ ધરાવે છે કે જ્યાં હૈયાત અને હાજર ઈમામના નૂરના દીવાનાઓ અમલી રીતે રૂહાનીયતના અનુભવોથી શાયદો મેળવે છે.

નામદાર સાહેબ ! આપની અગાહિત સેવાઓનું આ ટૂંકા આવકાર પ્રવચનમાં વર્ણન કરવું શક્ય નથી. ટૂંકમાં એ કે આપ સાહેબ ઈમામે જ્માનના ઈલ્મી ચમત્કારોની નિશાનીઓમાંથી એક મહાન નિશાની છે. આપના ગંધી અને પદ્ધી પુસ્તકો તથા આપની રૂહાની મજલીસો હજરત ઈમામ સુલતાન મુહમ્મદ શાહ (અ.સ.)ના આ પંવિત્ર ઇરમાનની ઠોસ સાભિતી છે કે “ઇસમાઈલી મજહબ રૂહાનીયતનું તખત છે.”

અંતમાં દુઆ છે કે આપ નામદાર સાહેબની દોરવાળી ડેઠળ પાકિસ્તાનના ઇસ્માઈલીયા એસોસીએશનની જે શાખા અહીં સ્થાપિત થઈ છે તે આપણી પાછલી ઇસ્માઈલી પ્રચાર ઝુંબેશની વ્યાજબી વારસદાર સાભિત થાય અને અહીંથી જ્ઞાન અને છિકમત તથા રૂહાની શિક્ષણથી સભર એવા કુમારીયત ભરેલાં દાઈઓ ઊભરે કે જે હાજર અને હૈયાત ઈમામની પંવિત્ર હીદાયતના પ્રકાશમાં ઇસ્લામ મજહબની સારી સેવા કરી શકે અને આ ઇલાકા બલ્કે સંઘળાં જગતમાં આપણા મહાન દાઈઓની જેમ ઇસ્લામની સર્ચાઈ અને છિકમત તથા જ્ઞાનને ફેલાવી દે.

સાથે એ પણ દુઆ છે કે આપ નામદાર જે મહાન હેતૂસર જે મહત્વના ઓછા ઉપર બિરાજ્યા છે, તેમાં ખુદાવંદતાલા અતી ઉત્તમ દરજજાની સફળતા તમને અર્પણ કરે - આમીન.

૧૧ જુન, ૧૯૭૨

દુઆના તલબગાર

પ્રમુખ અને મેમ્બરો

ધી પાક ઇસ્માઈલીયા લુંઝા (શનાકી) મલ્ટી
પરપા કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ - કરાચી.

